

ગુજરાતી વિશ્વકોશ

વર્ષ : 24 * અંક : ૪ * જાન્યુઆરી 2022 * કિં. ₹ 15



ગુજરાતી ભાષાનો સર્વપ્રथમ વિશ્વકોશ
(Encyclopedia in Gujarati)



ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ



ગુજરાતી વિશ્વકોશ
ભાગ ૧ થી ૨૫

મુખ્ય પૃષ્ઠ વિશ્વકોશ પંડસૂચિ લેખકસૂચિ વિપર્યસૂચિ અમારી વાત સંપર્ક

ગુજરાતી વિશ્વકોશ

સ્પષ્ટપત્ર ૧૬૮૫


શોધો

ગુજરાતી વિશ્વકોશના ૨૪,૦૮૩ અધિકરણોને સમાવતા ૨૫ ગ્રંથો

ઓનલાઇન મુકાયેલા



ગુજરાતી વિશ્વકોશના રૂપ ગ્રંથોને ઓનલાઈન
મુક્તી રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ



ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉઠમા સ્થાપનાટિન નિમિત્તે આયોજિત
વિશ્વસંસ્કૃતિપર્વ કાર્યક્રમમાં વક્તવ્ય આપતા
પ. પુ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને જ્ઞાણીતા વિજ્ઞાની ડૉ. પંકજ જોશી

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી મુદ્રક, પ્રકાશક અને તત્ત્વી : કુમારપાણ ડેસર્ટ, સંપાદક : પ્રીતિ શાહ
 પ્રકાશનસ્થળ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ૫૧/૨, રમેશપાઈની બાજુમાં, બંધુસમાજ સોસાયરી સામે,
 ઉસ્માનપુરા, અમદાવાદ ૩૮૦ ૦૧૩. ફોન : ૨૭૫૫ ૧૭૦૩, મુદ્રણસ્થળ : અધ્ય ઓફસેટ,
 સી-૧ ૨, બંસોધર મિલ કમ્પાઉન્ડ, બારડોલાપુરા, દારિયાપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૪

email : vishvakoshad1@gmail.com ◆ www.vishwakosh.org

ધૂટક કિંમત : ₹ ૧૫/-, વાર્ષિક લવાજમ ₹ ૧૫૦/-, ત્રણ વર્ષનું લવાજમ ₹ ૪૫૦/-

લવાજમ : 'ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ'ના નામે ડ્રાફ્ટ અથવા મ. ઓ.થી જ મોકલવું.

વિશિષ્ટ સહયોગ : શ્રી સી. કે. મહેતા (દીપક નાઇટ્રોઇટ)

[અહીં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની છે.]




કલાસ સે જુગાડ, ભોર કા ગટકા અને તોડ-ફોડ-નોડ

વર્તમાન શિક્ષણપદ્ધતિમાં વિદ્યાર્થીની વિચારશક્તિ અને ક્ષમતા પ્રમાણે ઘાટ આપવાને બદલે તમામ બાળકોને એક્સસરખા અભ્યાસક્રમથી શીખવવામાં આવે છે અને તેને પરિણામે એમની વિચારશક્તિ કુંઠિત બની જાય છે અને એમનામાં રહેલી સુષુપ્ત ક્ષમતા પ્રગટ થતી નથી. આથી જ ઓડિસાના કટક શહેરથી બાર કિલોમીટર દૂર આવેલા ૪૨ મોઉંડા ટાપુમાં બારલ ગામમાં વિદ્યાર્થીઓ શોધ-સંશોધનમાં રસ ધરાવે તેવી ઈન્ટરનેશનલ પલ્બિક સ્કૂલ ફોર રૂરલ ઈન્ફોરેશનની અનિલ પ્રધાને સ્થાપના કરી. વિદ્યાર્થીઓને નવાં નવાં શોધ-સંશોધનનોની મોકલાશ આપવી અને ટેક્નોલોજી દ્વારા ગામડામાં આપાતા શિક્ષણની ચુણવતા સુધારવી એ અનિલ પ્રધાનનો મુખ્ય ઉદ્દેશ છે. એથી એની શાળામાં વિદ્યાર્થીની અભિરૂચિ પારખીને એના કૌશલ્ય-વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

એની શાળામાં STEM (science, technology, engineering and mathematic) એટલે કે વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના વિષયોમાં તાત્ત્વિક શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો અને આજે તો માત્ર ગામડાંઓમાં જ નહીં, બલ્કે નગરો અને મહાનગરોમાં પણ આ STEM શિક્ષણપદ્ધતિમાં પોતાનાં બાળકોને પારંગત બનાવવા માટે માતા-પિતા આતુર હોય છે. આ પદ્ધતિની પાછળની અનિલ પ્રધાનની વિચારધારા એ છે કે બાળક કયા વિસ્તારમાંથી આવે છે, કેવી આર્થિક સ્થિતિ ધરાવે છે અથવા તો બાળક કઈ પૃષ્ઠભૂમિ ધરાવે છે, તે પરથી એની ક્ષમતાનું માપ કાઢી શકાતું નથી.

હીકુટમાં તો શિક્ષણમાં સ્વસ્થ અને તંદુરસ્ત વાતાવરણ તથા શીખવવાની પ્રક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. વળી ગામડાનાં આ બાળકોને સહેજ વિશેષાવિકૃત



માનવ જેવો બનાવેલો રોબોટ અનિલ અને વિદ્યાર્થીઓનું અનુકરણ કરે છે

વિદ્યાર્થીઓ જેવી તકો આપવામાં આવે, તો તેઓ અજાયબી સર્જ શકે છે. આ ગ્રામીણ વિદ્યાર્થીઓ મોટાં સ્વનાં જોઈ શકે છે અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રના પોતાના અનુભવોનો ઉપયોગ કરીને અનિલ પ્રધાન વિદ્યાર્થીઓની ક્ષમતાનો સેતુ બની રહે છે. શાળાના અભ્યાસક્રમમાં નાવીન્ય આણીને વિવિધ વર્ગના વિદ્યાર્થીઓને ભણાવવા માટે એણે ઘણી નવી પદ્ધતિઓ તૈયાર કરી છે.

અનુભવને આધારે અનિલ પ્રધાનને લાગ્યું કે કેટલાક વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો અત્યંત ડરામણા લાગતા હોય છે. આવા વિદ્યાર્થીઓની અભ્યાસ કરવાની રીતમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. આ યુવાનોને શાળામાં શીખવવામાં આવતા સૈદ્ધાંતિક જ્યાલો સાથે વ્યવહારું શિક્ષણને જોડવાનો સમય આવી ચૂક્યો છે. આમ કરીને જ આપણે આ યુવાનોને ૨૧મી સદીના વૈજ્ઞિક નાગરિક બનાવી શકીશું.

સૈદ્ધાંતિક જ્યાલો સાથે વ્યવહારું શિક્ષણ જોડવાથી વિદ્યાર્થીઓ વર્ગમાં જે વિષય શીખે છે, તેનાં વ્યવહાર-પાસાંથી પરિચિત બને છે. એ સ્વયં વિજ્ઞાનનો અનુભવ કરે અને એવું કરશે તો વિજ્ઞાનના વિષયથી ક્યારેય ડરશે નહીં. આને માટે અનિલ પ્રધાને ઘણી નવી ટેક્નિકો વિકસાવી છે, જે વિદ્યાર્થીઓની વિભાવનાઓ સમજવામાં મદદરૂપ બને. જેમ કે,

અનિલ પ્રધાને હસ્તલેખન માટે એક ઉપકરણ વિકસાવ્યું છે. એમાં સોય અને દોરા સિવાય બીજું કંઈ નથી. વિદ્યાર્થીઓને સોયમાં દોરો પરોવવા માટે આંગળીનો ઉપયોગ

અનુક્રમ

કબાડ સે જુગાડ, જોર કા ઝટકા

અને તોડ-ફોડ-જોડ ૩ કુમારપાળ દેસાઈ

ઉર્ધ્વગર પ્રજાના અસ્તિત્વ

સામે ખતરો ૭ પ્રવીણ ક. લહેરી

વિશ્વકોશનો ઐતિહાસિક પડાવ ૧૦ રમેશ તન્ના

પતંગની પાંખે : શોધકોની આંખે ૧૨ ચિંતન ભહ

બપોરની ઊંઘ વિશે ૧૫ રતિલાલ બોરીસાગર

કરુણાને એક અવસર તો આપો ! ૧૮ સંજ્ય-તુલા

હાઈડલબર્ગમાં મળેલાં આશ્ર્ય ૨૧ ભારતી રાણે

સ્થાપત્યમાં બિદ્ધ ૨૪ હેમંત વાળા

બધાં ૪ ઠલેક્ટ્રોનિક્સ ઉપકરણો

માટે એક જ ચાર્જર શક્ય છે ? ૨૭ હર્ષ મેસવાણિયા

પૃથ્વીની મૂરીનું બ્યાજ ચૂકવીએ ૩૦ પ્રીતિ શાહ

પ્રદ્યુમન તન્ના - ચિત્રકાર,

કવિ, ફોટોગ્રાફર, લેખક ૩૨ રમેશ બાપાલાલ શાહ

વિશ્વકોશવૃત્તા ૩૪ -

કરીને દરેક પ્રકારના ફેરફાર અને સંયોગીકરણ સાથે દોરો પરોવતાં શીખવાનું કહેવામાં આવે છે. એક વાર વિદ્યાર્થીને ખબર પડી જાય કે દોરો બહાર લાવવા માટે માત્ર તેમની તર્જની અને અંગૃહીનો ઉપયોગ કરવાની જરૂર છે, તો તેઓ પેન્સિલને કરી રીતે પકડવી તે આપમેળે શીખી લેશે અને આવી રીતે એ નર્સરીનાં બાળકોને પેન્સિલ પકડતાં શીખવે છે.

ભૂમિતિના વિષયમાં નવીનતા લાવવા માટે વિદ્યાર્થીઓ આકારો સમજે અને બાજુઓને માપતાં શીખે માટે 3-D પ્રિન્ટિંગનો ઉપયોગ કરાય છે. આવા પ્રયોગો અને સામૂહિક કાર્ય દ્વારા સમસ્યા સામે વિદ્યાર્થીઓમાં એક જુસ્સો ઉત્પન્ન કરે છે ને એ રીતે વિદ્યાર્થીઓ એમાં રસ લે છે. અત્યારે સ્થાનિક પ્રાદેશિક એવી ઊર્ડિયા ભાષામાં અનિલ પ્રધાન વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. એના ઈનોવેશન રૂમમાં 3-D પ્રિન્ટર, લેસર કટિંગ મશીનો, ડ્રિલિંગ મશીનો, પાનાં-પક્કડ, સ્કૂ-ડ્રાઇવર, વેલ્ડિંગ મશીનો અને બીજાં નાનાં-મોટાં સાધનો વસાવવામાં આવ્યાં છે. વળી આ તમામ મશીનો ‘kill switch technology’થી સજજ છે, જેથી વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત રહે. એની શાળામાં યોગ અને વ્યાયામના વર્ગો એકાંતરે ગોઠવે છે, તો નૃત્ય, સંગીત અને બીજા વિષયોનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે. આમાં મહત્વની બાબત એ છે કે બાળકને શું શીખવાનું છે, તેની જાણ એ વર્ગમાં આવે ત્યારે જ થાય છે અને આ રીતે બાળકની જિજ્ઞાસાવૃત્તિ કેળવાય છે. રોજ દસ મિનિટ શાળા અને વર્ગને સ્વચ્છ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને શાળાનાં પગથિયાં પર UN’s 17 Sustainable Development Goals લખાયેલાં હોય છે. આનો આશય એ છે કે બાળકો પગથિયાં ચડતાં જાય અને એ ધ્યેય વાંચતાં જાય અને મનોમન વારંવાર ગુંજન કરતાં જાય. અનિલ પ્રધાન એની શાળાનાં સત્રોનાં પણ વિદ્યાર્થીઓને ગમી જાય તેવાં નામ રાખે છે. જેમ કે, ‘કબાડ સે જુગાડ’, ‘જોર કા ઝટકા’ અને ‘તોડ-ફોડ-જોડ’. આમાં ‘કબાડ સે જુગાડ’માં બધા પ્રકારના ઈ-વેસ્ટ આપવામાં આવે છે, જેમાં મોટરના જુદા જુદા પાર્ટ્સ, ટેલિવિજન, રેફિજરેટર અને બીજી ચીજવસ્તુઓ હોય છે. એમાંથી પોતાની શોધઘોળ માટે એ કંઈક બનાવે તે માટે સગવડ આપવામાં આવે છે. એમને માટે જૈવિક કચરો જેવો કે રસોડાનો કચરો, શાકભાજી, કૂલો, પાંદડાં, ફળો, કાગળ, કાચ, ધાતુઓ, મશીનના ભાગો, પ્લાસ્ટિક વગેરે ભેગાં કરાય છે અને તેનો તેમના વર્ગમાં ફરી કેમ ઉપયોગ કરે છે, તે અંગે નિરીક્ષણ થાય છે. તે કચરાનો યોગ્ય ઉપયોગ કરાય, તો તે નકામી ચીજમાંથી શ્રેષ્ઠ સામગ્રી જેવી કે સુંદર હસ્તકલાના નમૂના, રમકડાં કે બાળકો માટે ઉપયોગી ચીજવસ્તુઓ બનાવી શકાય છે.

શાળામાં ઉત્પન્ન થયેલ કચરાને ઘટાડીને તેનો સરસ રીતે ઉપયોગ કરવાની રીત તો અજબ છે. વિજ્ઞાન, ટેક્નોલોજી અને ગણિતના ઘણા સિદ્ધાંતો સરળ છે અને તેનાં ઉદાહરણો આપણી આસપાસની દુનિયામાંથી જ મળી આવે છે. આ બાબતને ધ્યાનમાં લઈને ‘નવોન્મેષ પ્રસાર ફાઉન્ડેશન’ સસ્તી અને રોંકિંગ્સ સામગ્રીમાંથી પ્રયોગ કરે છે



વિદ્યાર્થીઓએ બનાવેલી લેન્ડ રોવર

અને મોડલો બનાવે છે. બીજે રીતે કહીએ તો નવોન્મેખ પ્રસાર ફાઉન્ડેશન ગરીબ બાળકો માટે વિજ્ઞાનને સુલભ બનાવે છે અને તેમના ઘરે તેની પ્રતિકૂતિ બનાવવી શક્ય બનાવે છે.

જ્યારે ‘જોર કા ઝટકા’માં ઈલેક્ટ્રોનિક્સ

સત્રમાં બાળકોને માઈકોકન્ટ્રોલર્સ અને માઈકોપ્રોસેસર જેવા નાના નાના રોબોટ બનાવાનું શીખવવામાં છે. ‘તોડ, ફોડ અને જોડ’ જોઈએ તો એ સત્રમાં વિદ્યાર્થીઓને ઉપકરણોના ભાગોને ધૂટા કરીને એ કેવી રીતે કાર્ય કરે છે તેની જાણકારી મળે તે માટે ફરીથી એને જોડવા માટે પ્રોત્સાહિત કરાય છે. ભુવનેશ્વરના ‘તોડ-ફોડ-જોડ’ કેન્દ્ર દૂરના વિસ્તારમાં અભ્યાસ કરતા આમિયા વિદ્યાર્થીઓને નાની ઉંમરમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતને (‘સ્ટેમ’ના વિષયો) તેમની માતૃભાષામાં શીખવે છે. તે યુવાનોને પોતાની ક્ષમતા વધારવા અને રોજગારની તક વધારવા માટે સક્ષમ પણ બનાવે છે. ગ્રામજનોને આવાં સાહસો માટે શહેરનાં સ્થળોએ જવું પડતું નથી, પણ આ કેન્દ્રમાં જ તેમને તેમની સમસ્યાનો ઉકેલ મળી જાય છે. વેદિંગ મશીનો, સુથારીકામ, 3-D પ્રિન્ટિંગ CNC (Computerized Numerical Control) અને લેસર કટિંગનું કૌશલ્ય મુખ્યત્વે યુવાનોને રોજગારી માટે શીખવવામાં આવે છે. આ કેન્દ્ર તેમને તેમના ઉત્પાદનની અજમાયશ કરવાનો અનુભવ આપે છે અને તેમની દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન કરે છે. કેટલાક યુવાનોનો સમૂહ પોતાની સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે ભુવનેશ્વરના કેન્દ્રમાં મળે છે. નાનાં ખેતીનાં સાધનોથી માંડીને તેને સંપૂર્ણપણે ડિઝાઇન કરી આપવા સુધીનું કામ આ કેન્દ્રમાં થઈ શકે છે. ઓડિસાના ૮૦૦ વિદ્યાર્થીઓના સમૂહમાંથી ટકોરાબંધ પચાસ વિદ્યાર્થીઓની ટુકડી તૈયાર કરી. આ વિદ્યાર્થીઓને કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં માર્ગદર્શન પૂરું પાડયું. હકીકતમાં તેમની આ ટુકડીમાંથી એક ટુકડી ભારતનું ‘નાસા’માં પ્રતિનિધિત્વ કરવા માટે ‘નાસા’ દ્વારા પસંદ કરાઈ હતી. આ ટુકડીએ અલાબામાના હન્ટવિલેમાં યોજાયેલા NASA Human Rover Challenge-2021માં પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ ટુકડીએ અનિલને આત્મવિશ્વાસ આપ્યો, જેના કારણે તે ભારતનો પ્રથમ multipurpose student satellite બનાવવામાં સફળ થયો છે. તેને લાગે છે કે કોઈ પણ કાર્ય સતત કરતા રહીએ, તો કંઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ બની શકાય છે.

— કુમારપાળ દેસાઈ



ઉઈગર પ્રજાના અસ્તિત્વ સામે ખતરો

ઉઈગર એ ચીનની એક લધુમતી કોમ છે, જે તે દેશમાં એ રંગ, ધર્મ અને સંસ્કૃતિમાં બિન્ન હોય છે અને તેથી તેના પ્રત્યે શંકા અથવા ભયની લાગણી પ્રવર્તતી હોય છે. તેમની બિન્નતાને સમજવાની જિશાસા બહુ જૂજ વ્યક્તિઓમાં જોવા મળે છે.

લધુમતીની વ્યાખ્યા અંગે જુદા જુદા અભિગમો જોવા મળે છે. પ્રથમ તો જે જૂથો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને સાથે સાથે તેમની સંખ્યા અલ્ય હોય છે એને લધુમતી ગણવાનું ધોરણ છે. આમ છતાં જે અલ્યસંઘ્ક સમાજ આર્થિક, સામાજિક કે રાજકીય કેત્રે પ્રભુત્વ ધરાવતો હોય, તો તેવાં જૂથોનો લધુમતીમાં સમાવેશ ન કરવાનું વલણ વાજબી છે. સંખ્યામાં અલ્ય પણ અંદુશ અને પ્રભાવમાં વ્યાપક હોય તેવા સમુદ્દરાયનો લધુમતીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. સમાજશાસ્ત્રીઓએ સંશોધનના આધારે લધુમતી જૂથોની વિગતો નક્કી કરી છે. જૈન સમુદ્દરાય અને કાર્ષાટકમાં લિંગાયત સમુદ્દરાયનો લધુમતીમાં સમાવેશ કરવામાં આવ્યો, ત્યારે અનેક વિચારકોએ તેનો વિરોધ કર્યો હતો. માત્ર ઓછી સંખ્યાના કારણે કોઈ જૂથને લધુમતીનો દરજાને કે લાભો આપવા ન જોઈએ તેવો મત પ્રગટ થયો હતો.

દરેક દેશમાં લધુમતી જૂથો હોય છે. તેની સંખ્યા કે ટકાવારીમાં તફાવત હોઈ શકે, પણ તેને માટે જરૂરી હક્કો અંગેનો ઠાવ યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં ૧૮મી ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. જોકે લધુમતીના રક્ષણ અને વિકાસની ખાતરી આપવાનો આશય ધરાવતા આ ઠાવનો પૂરતો કે અસરકારક અમલ થઈ રહ્યો નથી, તે સૌને વિદ્ધિ છે. લધુમતીની ચિંતા તેમની આગવી ઓળખ જળવાય, તેમની સાથે ભેદભાવ કે અન્યાય ન થાય, તેમનું શોષણ કે દમન ન થાય તેવા મુદ્દ પરત્વે હોય, તે સ્વાભાવિક છે.

ચીન આજે એક મહાસત્તા તરીકે સ્થાપિત થઈ રહ્યું છે ત્યારે ત્યાંની પ્રજાના ૮૧.૧૧ ટકા હાન્સ જાતિના છે. મોટા ભાગના ચીની લોકોની આ જાતિ (રેસ) હોવાથી આપણને તેના ચહેરા સરખા લાગે છે. હકીકતમાં ચીની લોકોની હાજરી અનેક દેશોમાં છે, જ્યાં તે લધુમતીમાં છે. ચીનમાં જે પણ લધુમતી જૂથો છે, તેની સંખ્યા ૮.૮૮ ટકા અંદાજવામાં આવી છે. ચીનની લધુમતીમાં નોંધપાત્ર સંખ્યા ધરાવતી લધુમતીઓની વિગત આ પ્રમાણે છે : (૧) જુઆંગ ૧.૬૮ કરોડ, (૨) હુઈ ૧.૫ કરોડ, (૩) મીજુ ૧.૦૩ કરોડ, (૪) ઉઈગર ૧.૦૩ કરોડ, (૫) મીઆયો ૮૪ લાખ, (૬) પી ૮૭ લાખ, (૭) નુજિયા ૮૩ લાખ, (૮) તિબેટિયન ૬૨ લાખ, (૯) માંગોલ પણ લાખ, (૧૦) ડેન ૮૮ લાખ, (૧૧) બ્યુઈ ૨૮ લાખ, (૧૨) યાઓ ૨૭ લાખ.

ચીને પોતાની વિસ્તારવાદી નીતિ તથા ખંધાઈ અને હવે તાકાતના સહારે ૧૪ જેટલા પાડેશી દેશો સાથે સરહદી વિવાદો ઊભા કરીને જે જે પ્રદેશો પર હકૂમત સ્થાપી છે



નવો વિસ્તાર થાય છે.) વસતા કરોડથી સવા કરોડ ઉઈગર લોકો સુન્ની મુસ્લિમ ધર્મ પાળે છે. તેના પર ચીની શાસકો દ્વારા થતા અત્યાચારનો મામલો ઉજાગર થયો છે. કોઈને રિબાવવા અને ત્રાસ આપવામાં તથા માનસિક રીતે ભાંગી પડે તેવી યાતના આપવામાં ચીનના સત્તાધીશોની કાર્યવાહી અતિ ફૂર, અમાનવીય અને ભયંકર હોય છે. આવી હીન પ્રવૃત્તિઓ બાદ પણ ચીનને નથી કોઈ શરમ કે નથી કોઈ સંકોચ.

ચીનમાં ઉત્તર પશ્ચિમે આવેલા શીનજીયાંગ પ્રાંતને ચીને 'ઉઈગર' સ્વાયત્ત પ્રદેશ જેવું રૂપાળું નામ આપ્યું છે, પણ ત્યાં સ્વાયત્તતાનો અંશમાત્ર નથી. લગભગ ૧૬.૬૪ લાખ ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર ચીનના પ્રદેશોમાં સૌથી વિશાળ પ્રાંત છે. તેની સરહદો માંગોલિયા, રચિયા, કાજખસ્તાન, ડિગિરિસ્તાન, તાજિકસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતને સ્પર્શે છે. ભારત સાથેના વિવાદિત વિસ્તારનો પણ આમાં સમાવેશ થાય છે.

મૂળ સિલ્ક રૂટ પર આવેલો આ પ્રદેશ અગાઉ ચીની તુર્કસ્તાન તરીકે ઓળખાતો હતો. આજે આ પ્રાંતની લગભગ ૪૪ ટકા વસ્તી ઉઈગરની છે પણ ચીને ૪૨ ટકા હાન્સ વસ્તીને આ ઉબડખાબડ, પ્રતિકૂળ હવામાન, રણ-પર્વતો અને વિવિધ દેશોથી ઘેરાપેલા પ્રદેશમાં વસાવી દીધી છે.

ઉઈગર પ્રજાની ઓળખમાં તેમનો તુર્કી સાથેનો સંબંધ જૂનો છે. તુર્કીનાં ૧૦થી અને ૧૧મી સઈનાં આકમણો બાદ કમશા: આ વિસ્તારોમાં ઈસ્લામ ધર્મ સ્થાપિત થયો છે. ઉઈગર પ્રજાની ભાષાઓમાં વૈવિધ્ય છે, પણ તેની ધાર્મિક ઓળખ મુસ્લિમાન હોવાની છે. ચીનની સામ્યવાદી સરકાર આવી બિન્ન સંસ્કૃતિ ધરાવતા અને ધર્મ પાળતા લોકો પ્રત્યે અસહિષ્ણુ છે. હાન્સ પ્રજા સાથે આ પ્રજાને ભેણવી દેવાનો ચીનનો મનસૂબો જગજાહેર છે. આ સમુદ્ધાયની વસ્તી ઘટે તે માટે ચીને અકલ્ય કડક પગલાંઓ લીધાં છે અને અહીં ચીને સંતાનપ્રાપ્તિ માટે પરમિત લેવાનો નિયમ અમલમાં મૂક્યો છે.

ઈ. સ. ૨૦૦૮માં થયેલાં તોઝાંગોમાં ૨૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પાછળ ઉઈગર પ્રજાની અલગ રાજ્યની માંગણીને કારણભૂત ગણીને ચીને ઉઈગર લોકો પર દમનનો છૂટો દોર મૂક્યો છે. અમેરિકા, બ્રિટન, નેથરલેન્ડ વગેરે રાષ્ટ્રોએ આક્ષેપ મૂક્યો છે કે ચીન ઉઈગર લોકોનો નરસંહાર કરી રહ્યું છે.

હજરો ઉઈગર મહિલાઓના તેની ઈચ્છા વિરુદ્ધ સંતતિનિયમનનાં ઓપરેશનો કર્યો છે. ઉઈગર લોકોને ઈસ્લામ ધર્મનાં પ્રતીકો વાપરવાની, કુરાનની પ્રત રાખવાની કે દાદી-ટોપી અથવા ધર્મને લગતાં ચિહ્નનો દૂર કરવાની ફરજ પાડી છે. આ ઉપરાંત મોટા ભાગની વસ્તીને પુનઃશિક્ષણના કેમ્પમાં રાખી તેમની માનસિકતા બદલવા તેમના પર અત્યાચારો થાય છે. ચીન આ સંઘળા આંકેપોનો ઈન્કાર કરે છે, પણ તેના બચાવનામાની અમુક વાતો સમજવા જેવી છે.

તેઓ કહે છે કે ઉઈગર પ્રજામાંથી ગ્રાસવાદી વૃત્તિ દૂર કરી દેશના નાગરિક બનાવવા આવું પુનઃશિક્ષણ જરૂરી છે. ઈસ્લામ મૂળે ચીનનો ધર્મ નથી તેથી તે ધર્મ પાળનાર સમુદ્દ્રાય અમારી રાષ્ટ્રીય સલામતીને ખતરારૂપ ન બને તે માટે એમના પર નિયંત્રણો અનિવાર્ય છે. ઉઈગર પ્રજા ચીનની પ્રજા સાથે ભળી જાય તે માટે તેઓની પરંપરાગત માન્યતાઓ અને પૂર્વગ્રહો દૂર કરવાની જરૂર છે. આડકતરી રીતે ચીન કબૂલે છે કે ઉઈગર પ્રજાનો ઈસ્લામ ધર્મ અને તેની અલગ ઓળખ અમને સ્વીકાર્ય નથી. નાગરિકોને પોતાની વિચારખારા મુજબ સુધારવાના પ્રયત્નો કરવા અને જો ધાર્યું પરિણામ ન આવે તો તેવા વિરોધીઓને ગ્રાસ આપીને તેનું જીવન સમાપ્ત કરવું. ચીનની જ નહીં કિંતુ દરેક સાખ્યવાદી દેશમાં ધાર્મિક સ્વાતંત્ર્ય કે માનવહક્કનો પ્રશ્ન નથી. ૧૯૮૦ પહેલાં મધ્ય એશિયાનાં જે ઈસ્લામિક રાષ્ટ્રો રચિયાના પ્રભુત્વ નીચે હતાં, ત્યાં પણ મુસ્લિમ ધર્મ પાળવા પર પ્રતિબંધ હતો.

જોગાનુજોગ ઈસ્લામ પણ સાખ્યવાદી જેટલો અન્યની સ્વતંત્રતા મુદ્દે અસહિષ્ણું છે. આશ્ર્ય એ વાતનું છે કે ઈસ્લામ ધર્મના લોકોના મુદ્દે અન્ય દેશોની ટીકા કરનાર મુસ્લિમ રાષ્ટ્રોએ ચીનના ઉઈગર લોકો પર સતત ચાલતા અત્યાચારો સામે મૌન ધારણ કર્યું છે. આજે તુર્કી ઉદારવાદી ઓળખ છોડીને કમાલ આતાતુર્કના માર્ગથી વિચલિત થઈ ફરી કહેવાએ તરફ પગરણ માંડી રહ્યું છે, તે પણ આ મુદ્દે એક શબ્દ પણ બોલતું નથી. ઉઈગર પ્રજાની ભાષા તુર્કી ભાષાને મળતી આવે છે. તુર્કીએ આ પ્રદેશોમાં ઈસ્લામ ફેલાવ્યો છે. તુર્કી સાથે ગાઢ સંબંધ ધરાવતી, મુસ્લિમ ધર્મ પાળતી ઉઈગર લઘુમતીને ચીનના ગ્રાસ સામે રક્ષણ આપવા કોઈ ઈસ્લામિક દેશ તૈયાર નથી, ત્યારે આપણાને તુલસીદાસની એ પંક્તિનું સ્મરણ થાય : ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ’.

ચીન માટે કપાસની ખેતી દ્વારા વિશ્વના રૂ ઉત્પાદનમાં ૨૦ ટકા હિસ્સો ધરાવનાર અને ખનિજ સંપત્તિથી ભરપૂર ઉઈગરનો મૂળપ્રદેશ શીનજીયાંગ પ્રાંત ખૂબ મહત્વનો છે. ઉઈગરની અલગ ભાષા, સંસ્કૃત અને ધાર્મિક પદ્ધતિઓ નેસ્તનાબૂદ કરવા સાથે આ લઘુમતી જૂથોનો સફાયો કરવામાં ચીન સફળ ન થાય, તે માટે આંતરરાષ્ટ્રીય ધોરણે અતિશય દબાણ થાય કે ચીન નબળું પડે તો જ ઉઈગર જાતિની સુરક્ષા થઈ શકશે. તિબેટ અને શીનજીયાંગ પ્રાંતો ચીનથી અલગ છે. ચીન તેનો સંસ્થાનો તરીકે કબજો લઈને શોખણ અને અન્યાયનું દુષ્યક ચલાવે છે તે રોકી ચીનની લઘુમતીઓનો વિનાશ રોકવો જરૂરી છે. આશા રાખીએ વિશ્વના દેશો જાગૃત થઈ એક અવાજે ઉઈગર પ્રજાના અસ્તિત્વ પરનો ખતરો ટાળવા માટે જરૂરી કાર્યવાદી કરશે.



વિશ્વકોશનો ઐતિહાસિક પડાવ

સત્તા બારના ઉતારા, પાસબુક અને ચેકબુકને જ દસ્તાવેજ માનનારી પ્રજાની માતૃભાષા ગુજરાતીમાં વિશ્વકોશનું સર્જન કરનારા ડૉ. ધીરુભાઈ ઠાકર સ્વર્ગમાં રાજી થયા હશે તેવું એક મહત્વનું કાર્ય હમણાં થયું છે. કુમારપાળ દેસાઈના સક્ષમ, કુશળ અને ચુસ્ત નેતૃત્વમાં સવા કરેની શબ્દસંખ્યા ધરાવતો વિશ્વકોશ ઓનલાઈન ઉપલબ્ધ થયો છે. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ વિશ્વકોશ (અન્સાઈલોપીરિયા) પ્રગટ કરનાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ૧૯૮૭થી ૨૦૦૮ સુધીના બાવીસ વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના ૨૫ ગ્રંથોનું પ્રકાશન કર્યું હતું. ૧૭૦ જેટલા વિષયો સમાવતો, ૨૪,૦૮૩ લખાણોવાળો ગુજરાતી વિશ્વકોશ ગુજરાતનો સૌથી મોટો જ્ઞાનસાગર બની રહ્યો છે.

સમયની માગ હતી કે ગુજરાતી વિશ્વકોશ ગ્રંથમાંથી ઝીન પર આવે. હવે જમાનો ઓનલાઈનનો છે. (દેશ ભલે હજુ લાઈનસર નથી થયો, પણ ઓનલાઈનની બોલબોલા છે. આશા રાખીએ કે દેશને લાઈનસર કરવામાં ઓનલાઈન પદ્ધતિ મદદ કરે.) આવડા મોટા વિશ્વકોશને, તેના દળદાર ૨૫ ગ્રંથોને ઓનલાઈન કરવાનું કામ સહેજે સહેલું નહોતું, પરંતુ હવે <https://gujarativishwakosh.org> ટાઈપ કરવાથી તે ઉપલબ્ધ થશે.

આ ઓનલાઈન વિશ્વકોશના દરેક વોલ્યુમમાં એ ગ્રંથ જે વર્ષે પ્રકાશિત થયો હોય તેનું વર્ષ મળશે, જેથી એનો ઘ્યાલ આવશે કે ક્યા સમય સુધીની માહિતી આ અધિકરણમાંથી ઉપલબ્ધ થશે. આ ગ્રંથો વિશ્વકોશના અધિકરણના શીર્ષકથી, લેખકના નામથી કે એના વિષયથી ‘સર્વ’ કરીને એમ ગ્રણ રીતે એની માહિતી મેળવી શકાશે. જ્યારે લેખકના નામથી સર્વ થાય, તે વખતે એ નામ જે જે લેખમાં આવતું હશે, એ લેખ પણ તમને સાથે દેખાશે.

આ સામની મોબાઈલમાં પણ ગુજરાતી ક્રી-બોર્ડ ઇન્સ્ટોલ કર્યા પછી ઓનલાઈન જોઈ શકાશે. આમ કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં આ ચોવીસ હજારથી વધુ લખાણો પ્રાપ્ત થશે. ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિશિષ્ટ વક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ કેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય આમાંથી પ્રાપ્ત થશે તેમજ નિષ્ણાતો દ્વારા લખાયેલા સ્વતંત્ર લેખોથી વિશ્વ વિશે અને ભારત વિશે અધ્યતન અને પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થશે.

કુમારપાળ દેસાઈ જેવા સફળ અને ચ્યાપળ સુકાનીના નેતૃત્વ હેઠળ અને ઈન્ફર્મેશન ટેકનોલોજીના અનુભવી પૂર્વિન દેસાઈના કાર્ય સાથે વિશ્વકોશે આ યોજના સાકાર કરવા માટે એક અલાયદી ટીમ બનાવી હતી. ગુજરાતી વિશ્વકોશના એકથી પચીસ ગ્રંથોમાં માનવવિદ્યાના ૮,૩૬૦; વિજ્ઞાનના ૮,૦૮૩; સમાજવિદ્યાના ૭,૬૪૦ એમ ૨૫ ગ્રંથોમાં કુલ ૨૪,૦૮૩ લખાણો મળે છે. જેમાં ૭,૬૪૭ લખાણરિતો,

૫૬૩ વ્યાપ્તિલેખો, ૧૧,૬૬૦ ચિત્રો અને ૨૪૬ અનુવાદિત લેખો ગુજરાતની પ્રજાને ઓનલાઈન ઉપલબ્ધ કરાવાય. આ ઓનલાઈન વિશ્વકોશના દરેક વોલ્યુમમાં એ ગ્રંથ જે વર્ષે પ્રકાશિત થયો હોય તેનું વર્ષ મળશે, જેથી એનો જ્યાલ આવશે કે કયા સમય સુધીની માહિતી આ અધિકરણમાંથી ઉપલબ્ધ થશે. આ ગ્રંથો વિશ્વકોશના અધિકરણના શીર્ષકથી, લેખકના નામથી કે એના વિષયથી ‘સર્ચ’ કરીને એમ ગ્રંથ રીતે એની માહિતી મેળવી શકશે.

જ્યારે લેખકના નામથી સર્ચ થાય, તે વખતે એ નામ જે જે લેખમાં આવતું હશે, એ લેખ પણ ભાવકને સાથે દેખાશે. આ સામગ્રી મોબાઇલમાં પણ ગુજરાતી ડી-બોર્ડ ઇન્સ્ટોલ કર્યા પછી ઓનલાઈન જોઈ શકશે. આમ કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઇલમાં ચોવીસ હજારથી વધુ લખાણો પ્રાપ્ત થશે. ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૂહ રસપૂર્ણ અધિકૃત પરિયય આમાંથી પ્રાપ્ત થશે તેમજ નિષ્ણાતો દ્વારા લખાયેલા સ્વતંત્ર લેખોથી વિશ્વ વિશે અને ભારત વિશે અધ્યતન અને પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થશે.

નવી પેઢી ડિજિટલ પેઢી છે. તે ઓનલાઈન પેઢી છે. એને બધું પરદા પર જોવાની, વાંચવાની, માણવાની અને શોધવાની ટેવ છે. ગુગલ સહિત અન્ય સુવિધા છે જ્યાં તમે તમારે જોઈતી હોય તે માહિતી શોધી શકો છો, પણ એમાં ક્યારેક અધિકૃતતાની સમયા થતી હોય છે. ગુજરાતી વિશ્વકોશમાં જે માહિતી ઉપલબ્ધ કરાવાઈ છે એ માહિતી એક-બે નહીં, સતત ગળણે ગળીને મૂકવામાં આવી હોય છે. એમાં ખોટી માહિતી, અધૂરી માહિતી, ભળતી માહિતીનું જોખમ રહેતું નથી.

એક વખત ફાધર વાલેસ અમદાવાદમાં આવેલા. તેમના જાહેર કાર્યક્રમો પોજાયેલા. આ લખનાર તેનો સંયોજક હતો. એક વાચકનો ફોન આવ્યો. તેણે કહ્યું કે ફાધર વાલેસને કહો કે તેમણે એક પુસ્તકમાં નહેરુબ્રિજ(અમદાવાદ)ની સ્થાપના તારીખ લખી છે એ ખોટી છે. આ લખનારે ફાધર વાલેસને આ વાત પહોંચાડીને પૂર્ણું કે આપે નહેરુબ્રિજનો સ્થાપના સમય ક્યાંથી મેળવીને લખ્યો હતો? નાના બાળકની જેમ, નિર્દોષતાથી કહ્યું કે ગુગલ પરથી.

આવું થાય છે. ક્યારેક ગુગલની માહિતીમાં ભૂલ કે ચૂક હોય છે. એ માહિતીનો મહાસાગર છે, પણ એ અધિકૃત સ્નોત નથી. હવે ગુજરાત વિશ્વકોશના તમામ ગ્રંથો ઓનલાઈન ઉપલબ્ધ થયા છે એટલે જેને જરૂર હશે તે અધિકૃત માહિતી મેળવી શકશે.

અત્યાર સુધી ગુજરાતમાં કે ગુજરાતી ભાષામાં થયેલાં સૌથી મહત્વનાં પાંચ કાર્યોની સૂચિ બનાવવી હોય તો તેમાં ગુજરાતી વિશ્વકોશની રચનાનો ચોક્કસ સમાવેશ કરવો પડે. પહેલાં ડો. ધીરુભાઈ ઠાકરના નેતૃત્વમાં અને હવે કુમારપાળ દેસાઈના માર્ગદર્શનમાં તેની જબરજસ્ત કામગીરી થઈ રહી છે. ગુજરાત વિશ્વકોશનું ગ્રંથોમાં અને હવે ઓનલાઈન ઉપલબ્ધ થતું સાત કરોડથી વધુ ગુજરાતીઓ માટે આનંદ અને ગૌરવની ધર્તના ગણાવી જોઈએ.



પતંગની પાંખે : શોધકોની આંખે

૧૪મી જાન્યુઆરી - ઉત્તરાયણ - મકરસંકાંતિ - આ દિવસ આપણે સૌ - ખાસ કરીને અમદાવાદીઓ અને સૂરતીઓ કુદરત સાથે તાદાત્મ્ય કેળવીને પતંગ, પવન અને તડકાને એક સાથે માણીએ છીએ. ખગોળશાસ્ત્રીઓ કહે છે કે એક સમયે આ દિવસે સૂરજની ગતિમાં એક ચોક્કસ બદલાવ આવતો હતો. તે દિવસ તો કાળકમે બદલાઈ ગયો છે છતાં પણ આપણે તો ૧૪મી જાન્યુઆરીને જ સંકાંત ગણીએ છીએ. મોટેભાગે આ દિવસે વરસાદ નથી આવતો કે વાતાવરણમાં બેજ પણ નથી હોતો. બેજયુક્ત વાતાવરણમાં પતંગ ચગાવવા માટે વિશિષ્ટ કૌશલ્યની જરૂર પડે છે. ‘ઉડવા માટે પાંખ’ એ આપણી સાહિત્યિક કલ્પના છે. તો ચાલો, આજે આપણે પતંગની પાંખે પતંગના કેટલાક જરા હટકે ઉપયોગો અને પ્રયોગો પર એક નજર નાખીએ.




પતંગ-પ્રયોગ

લગભગ ત્રણસો વર્ષ પહેલાં વિજ્ઞાનનાં ઘણાં રહેસ્થો પર હજુ પડ્યો જ હતો. આકાશી વીજળી વિશે પણ લોકોને માહિતી ન હતી. વીજળી સુધી પહોંચવા માટે પતંગ જ હાથવગું સાધન હોઈ શકે તેવો મત વિજ્ઞાનીઓનો હતો. ૧૭૫૦ના અરસામાં

આકાશી વીજળી ચર્ચનો વિષય રહ્યો હતો. ૧૭૫૨માં અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફેન્કલિને (Benjamin Franklin; 1706 - 1790) પતંગ મારફતે વીજળીને આકાશથી ધરતી પર ઉતારવાનો પ્રયોગ સૂચ્યવ્યો. તેમને વીજળીની પ્રચંડ તાકાતનું અનુમાન હતું તેથી તેમણે વાદળોમાંથી ઈલેક્ટ્રિક ચાર્જ એકઠા કરવાની વાત કરી. બેજને કારણે પતંગ ભીનો થઈ જાય તે સમસ્યાના ઉપાય માટે તેમણે રેશમી રૂમાલનો પતંગ બનાવ્યો. માનવામાં આવે છે કે જૂન, ૧૭૫૨ દરમિયાન ફેન્કલિને આ ‘પતંગ-પ્રયોગ’ અમેરિકાના ફિલાડેલ્ફિયા પ્રાંતમાં કરીને વાદળના ઈલેક્ટ્રિક ચાર્જને પતંગ દ્વારા ‘લેડેન જાર’ (Leyden jar)માં કેદ કર્યા હશે. લેડેન જાર ઈલેક્ટ્રિક ચાર્જને કેદ કરવાનું પ્રાથમિક રૂપ છે. તેનું વર્તમાન રૂપ ‘કેપેસિટર’ છે. ધાતુના તારથી પતંગ ઉડાડી ચાર્જ એકઠા કરવાનું ભયજનક હોવાથી ફેન્કલિને પતંગ ચગાવવા માટે રેશમી ઢોરીનો ઉપયોગ કર્યો. ચાર્જને ધરતી પર ઉતારવા માટે તેની સાથે ખાસ બનાવેલી શાણની ઢોરી પણ રાખી. શાણ જલદી બેજ શોખીને લાંબા સમય સુધી ભીનું રહે છે. બેજવાળા વાતાવરણમાં પતંગની ભીની થયેલી શાણની ઢોરી પ્રમાણમાં સહેલાઈથી ચાર્જનું વહન કરી શકે છે.

રેશમની દોરી અને પતંગ ભીનાં ન થાય તે માટે તેમણે ખાસ તકેદારી રાખી હતી. શાણની દોરીના આકાશ તરફના - પતંગ સાથેના - છેડા પર ચાર્જ એકડો કરવા માટે ઘરની એક ચાવી બાંધી અને તેનો બીજો છેડો લેણ



બે પાંખવાળો પતંગ

દીકરા વિલિયમની સહાયતાથી કરેલો આ પતંગ-પ્રયોગ સફળ રહ્યો. આ પ્રયોગથી તેમણે સિદ્ધ કર્યું કે ઈલેક્ટ્રિક ચાર્જના ડિસ્ચ્યાર્જથી આકાશી વીજળી થાય છે. સદ્ગુરીને ફેન્કલિનનો પતંગ અને આકાશી વીજળીનું મિલન ન થયું. થયું હોત તો શું થાત, તેની કલ્પના પણ થઈ શકતી નથી.

ફેન્કલિને એક સુવાહક સણિયા દ્વારા આકાશી વીજળીને 'લેણ જર'માં ઉત્તરવાની પણ વાત કરી. આ માટે ઊંચા મકાનની ટોચ પર ધાતુનો ઊંચો સણિયો લગાવીને તેને ધાતુના તારથી જાર સાથે જોડવામાં આવે અને પછી તો...વીજળી પડે તેની રાહ જોવાની. આ પ્રયોગ જુદા જુદા વિજ્ઞાનીઓએ જુદી જુદી જગ્યાએ કર્યો. એકાદ વર્ષ પછી ઓગસ્ટ, ૧૭૫૭માં રશિયન (હાલના સ્વીડિશ) વિજ્ઞાની જ્યોર્જ રિચમન્ન (George Wilhelm Richmann; 1711 -1753) આ પ્રયોગ માટે બધી જ ગોઠવણ કરી. એક દિવસ જગ્યારે તેઓ એક વિજ્ઞાનલક્ષી સભામાં પ્રવચન આપી રહ્યા હતા ત્યારે વાદળો ઘેરાયાં અને વીજળી થવા લાગી. પોતાનું પ્રવચન અધૂરું છોડીને આ વિજ્ઞાની પ્રયોગશાળામાં ધસી ગયા. આ સમયે પ્રચંડ આકાશી વીજળીનું ધરતી પર અવતરણ પણ થયું. તેને કારણે થયેલા અક્ષમાતમાં રિચમન્ને જીવ ગુમાવ્યો.

પતંગને ઉડતો જોઈને ચિત્રકાર લિયોનાર્ડી દ વિન્ચીએ (૧૪૮૨-૧૫૧૮) વિમાનનો સૌથી પહેલો સ્કેચ બનાવ્યો હતો. વર્ષો પછી 'રાઈટ બંધુઓ'એ (૧૮૭૧-૧૯૪૮) તેને મૂર્તિમંત કર્યો. અલબત્ત, વિમાન ઉડાડવાના અખતરામાં ઘણા ઈજનેરો/વિજ્ઞાનીઓ ખુલાર થઈ ગયા. રાઈટ બંધુએ ઉપર-નીચે બે પાંખવાળો પતંગ ઉડાવીને પોતાના વિમાનની ડિઝાઇનને ચકાસી હતી. ૧૮૮૮માં કરેલા આ પ્રયોગમાં પાંખની લંબાઈ પાંચ ફૂટની હતી. આમ વિમાનના વિકાસ માટે પંખી અને પતંગ પ્રેરણાનો ઝોત બન્યાં.

એક સમયે યુદ્ધ દરમિયાન પણ પતંગનો ઉપયોગ થતો હતો. નવાઈ લાગી ને! આનંદ અને ઉજવણી દર્શાવવા માટેનું માધ્યમ બનતો પતંગ યુદ્ધમાં કઈ રીતે ઉપયોગી થતો હશે? જ્ઞાપાનીઝ લોકો પતંગ સાથે વંટડી બાંધીને તેને દુશ્મનની છાવણી ઉપર રાત્રે ઉડાડતા હતા. દુશ્મનો અચાનક આકાશમાંથી આવતો વંટડીનો અવાજ સાંભળી ગભરાઈ જતા હતા. તેમને લાગતું કે આ કોઈ દુષ્ટભાનો કોપ છે અને તેઓ માનસિક રીતે ભાંગી પડતા. તો કોરિયાએ પતંગનો ઉપયોગ યુદ્ધ દરમિયાન સૈનિકોને સંકેતો મોકલવા માટે કર્યો હતો. પતંગના માધ્યમથી તેઓ વિવિધ સૈન્યટુકડીઓ વચ્ચે સંકલન

સાધતા હતા. માહિતી અનુસાર એક સમયે યુરોપમાં પતંગનો ઉપયોગ અંતર માપવા માટે થતો હતો. તેને માટે પતંગને લક્ષ્ય સુધી પહોંચાડીને તે ત્યાં નાચ થઈ જાય તેવી વ્યવસ્થા કરી હતી. ત્યાર પછી દોરી માપીને અંતરનો તાગ મેળવાતો હતો. વીસમી સદીની શરૂઆતમાં અમેરિકન વિજાની સેમ્યુઅલ ફેન્કલિન કોરીએ (૧૮૬૭-૧૯૧૩) અતિ વિશાળ પતંગ બનાવ્યો. તે માણસ સાથે પણ ઊરી શકે તેટલો વિશાળ હતો. તે માનવપતંગ (mankite) તરીકે ઓળખાયો. પતંગ સાથે ઊડેલો માણસ દુશ્મનના સૈન્યનું સ્થાન તેમ જ અન્ય વિગતોનું અવલોકન કરી પોતાના સૈન્યને માહિતી પૂરી પાડતો હતો. આ પ્રકારના માનવપતંગનો ઉપયોગ બ્રિટિશ સૈન્ય પ્રથમ વિશ્વયુદ્ધની અગાઉના સમય સુધી કરતું હતું. માનવપતંગનું પગેરું છેક ઈ. સ. પૂ. ૪૭૫૩૦૨ ૨૨૧ સુધીના ગાળામાં ચીનમાં નીકળે છે. કહેવાય છે કે અતિ વિશાળ પતંગનો ઉપયોગ યોજ્ઞાઓ અને માલસામાનના પરિવહન માટે પણ થતો હતો.

વર્તમાન સમયમાં સૌથી મોટી સમસ્યા ઊર્જાના સુકાતા જતા ઓતોની છે. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં શું પતંગ મદદ કરી શકે? આ માટે ઈટાલિયન સંશોધકોએ એક ઉમદા વિચાર આપ્યો છે - કાઈટ વિન્ડ જનરેટરનો. તેને કાઈટજેન (KiteGen) કહેવામાં આવે છે. પતંગના માધ્યમથી વીજળી ઉત્પન્ન કરતું આ જનરેટર પતંગના બનાવેલા ફંજેટફાળકા જેવું દેખાય છે. ચોક્કસ રીતે ગોઠવેલા અને ઊડતા વિશાળ પતંગો જનરેટરને ફેરવે છે. સતત ઊડતા પતંગો સતત વીજળી પણ ઉત્પન્ન કરે છે. પતંગ દ્વારા ચાલતું દુનિયાનું સૌપ્રથમ પાવરસ્ટેશન સ્કોટ્લેન્ડમાં આકાર લઈ રહ્યું છે. વિજાનીઓના મત મુજબ આ રીતે મેળવેલી વીજશક્તિ કિફાયતી પણ હશે.

આજે જે પ્રકારની ફોટોગ્રાફી ડ્રોનથી થાય છે તે પ્રકારની ફોટોગ્રાફી પતંગથી થતી હતી. અમેરિકના વિલિયમ એડી(William Abner Eddy)એ આ માટે બનાવેલી પતંગની પેટન્ટ પણ લીધી હતી. ૧૮૦૮માં અમેરિકના સાનફાન્સિસ્કોમાં આવેલા ધરતીકંપની ફોટોગ્રાફી માટે પતંગનો ઉપયોગ થયો હતો. આમ પતંગના વિવિધ ઉપયોગો થતા હતા અને થાય છે. જર્મન કંપની સ્કાયસેઇલ્સ (SkySails) તેના માલવાહક જહાજને ખેંચવા માટે વધારાનું બળ આપવા માટે પતંગનો ઉપયોગ કર્યો જેનું પરીક્ષણ રૂપોત્તમાં આય્યું હતું. આ પરીક્ષણથી જાણવા મળ્યું કે સાનુક્કણ પવન વખતે તેનાથી ઈધશા-કાર્યક્રમતામાં ૩૦ %નો ફાયદો થાય છે. ૧૬૦ વર્ગ મીટરના વિશાળ પતંગથી આંશિક શક્તિ મેળવતું એમએસ બેલુગા સ્કાયસેઇલ્સ વિશ્વનું પ્રથમ માલવાહક જહાજ છે. અલબત્ત, પવનશક્તિથી સઢવાળી હોડી હંકારવાની નવાઈ નથી, પરંતુ પતંગના ઉપયોગથી તેના કરતાં ૨૫ % જેટલી વધુ શક્તિ મળે છે. અરે હા, બિનતારીય સંદેશાચ્ચવહાર માટે ઊંચે ઓન્ટિના ગોઠવવા માટે માર્કોનીએ પણ પતંગનો ઉપયોગ કર્યો હતો.

મનોરંજન કે પછી બહુ બહુ તો જાહેરાતના સાધન તરીકે આપણે પતંગને ઓળખીએ છીએ. સામાન્ય પતંગ કેટલીક વૈજ્ઞાનિક શોધ અને એન્જિનિયરિંગ સંરચનાના વિકાસ માટેનું પહેલું પગથિયું બન્યો છે.

- ચિત્રન ભડ્ય



બપોરની ઉંઘ વિશે

આજે મારે ઉંઘ વિશે એક દિવ્ય સંદેશ આપવાનો છે. આજ સુધી આપણા ચિંતકોએ જે સંદેશાઓ જગતને આપ્યા છે તે સધળા જાગવા વિશેના જ છે. ઉંઘ વિશે સંદેશ આપવા જેટલી જાગૃતિ આપણા ચિંતકોએ બતાવી નથી. આ જવાબદારી આજે હું ઉપાડી રહ્યો છું.

‘આપણી જિંદગીનો ત્રીજો ભાગ ઉંઘવામાં જ વેડફાઈ જાય છે.’ આવા હિસાબો રજૂ કરીને ચિંતકો આપણને હેઠળોણે છે, ઉંઘવા અંગે હતોત્સાહ કરે છે અને જાગવા માટે ઉશ્કરે છે. પણ આજે હું આ હકીકત અંગે એક નવો દાખિકોષ આપવા માગું છું. આપણે યોવિસ કલાકમાંથી આઠ કલાક ઉંઘીએ છીએ એટલે આપણી જિંદગીનો ત્રીજો ભાગ ઉંઘવામાં જાય છે એ ખરી વાત છે, પણ ‘આપણી જિંદગીનો ત્રીજો ભાગ ઉંઘવામાં વેડફાઈ જાય છે’ એવું કેવી રીતે કહેવાય? આઠ કલાકની ઉંઘ એ પરમકૃપાળું પરમાત્માનું આયોજન છે. આ આયોજનનું આવું ખોટું અર્થધટન કરવું તે ઉચિત નથી. આપણે ઉંઘતાં હોઈએ છીએ ત્યારે ઈશ્વરની વધુ નજીક હોઈએ છીએ. ઉંઘતા તમામ મનુષ્યો સજજન હોય છે - એટલા સમયગાળા પૂરતા તો સજજન હોય જ છે. જાગતા બધા મનુષ્યો વિશે આવું કહી શકાશે? એટલે જિંદગીનો જે ૧/૩ ભાગ ઉંઘવામાં જાય છે એ જ ખરેખર તો જિંદગીનો સાર્થક ભાગ છે. જિંદગીનો જે ૨/૩ ભાગ જાગવામાં જાય છે એ જ ભાગ ખરેખર તો વેડફાટો હોય છે. તેથી હું રાત્રે જ નહિ બપોરે પણ ઉંઘવાની હિમાયત કરું છું.

હું માનું છું કે દરેક જાગ્રત મનુષ્યે બપોરના સમયે ઉંઘવું જોઈએ. હું જાણું છું કે બાળકો અને વૃદ્ધો સિવાય બપોરે ઉંઘવાનું કોઈને માટે સહેલું નથી. નોકરી કરનારાંઓને બપોરે સૂવા મળતું નથી. જોકે સરકારી કર્મચારીઓ આમાં અપવાદરૂપ છે. મોગલ બાદશાહ ઔરંગજેબ ચાલુ યુદ્ધ તોપોના ધડકાઓ વચ્ચે ઉંઘી શકતા કે સમાટ નેપોલિયન ઘોડા પર બેઠાં બેઠાં ઉંઘી શકતા એ રીતે સરકારી કર્મચારીઓ ચાલુ ઓફિસે ખુરશીમાં બેઠાં બેઠાં ઉંઘી શકે છે; પણ, ઉંઘનો આ માર્ગ સરળ નથી હોતો. ઈર્ષાળું બોસ ગમે ત્યારે આવી ચેત તો મેમો પકડાવી દે. એટલે બે નંબરનાં નાશાં જેમની પાસે હોય છે તેઓ ઈન્કમટેક્સવાળાઓથી ફફડતા હોય છે એમ આવી બે નંબરની ઉંઘ લેનારાઓ બોસથી ફફડે છે. એટલે ખરેખર તો કર્મચારી યુનિયનોએ મધ્યાહ્નનિદ્રાના અધિકાર માટે લડત આપવી જોઈએ. અત્યારે અડધો કલાકની રિસેસ પડે છે એને બદલે દોઢ કલાકની રિસેસ પાડવી જોઈએ. અડધો કલાક જમવા માટે અને એક કલાક ઉંઘવા માટે. રિસેસ પડે એ સમયે ઘંટ વાગે અને રિસેસ પૂરી થાય ત્યારે પણ ઘંટ વાગે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જોકે રિસેસ પડે ત્યારે ઘંટ વગાડવાનું ન રાખીએ તો ચાલે; કેમકે, લગભગ દરેક સરકારી ઓફિસમાં રિસેસ પડવાના ખરેખરા સમયથી દસ-પંદર મિનિટ વહેલી

રિસેસ શરૂ થઈ જતી હોય છે અને એ સમય માટે કોઈને સતર્ક કરવાની જરૂર નથી પડતી, પણ રિસેસ પૂરી થાય ત્યારે ઘંટ વાગે એવી વ્યવસ્થા તો રાખવી જ પડશે. નહિતર કેટલાક કર્મચારીઓ-અધિકારીઓ ઓફિસ પૂરી થવાના સમય સુધી સૂતા રહેશે ને, સાંજે ઓફિસ બંધ કરનાર કર્મચારીને કોઈ સૂઈ તો નથી રહ્યું ને, એની ખાતરી કરવી પડશે. ઘંટ વગાડીને કર્મચારીઓને જગાડનારા કર્મચારીઓની નવી જગ્યાઓ મંજૂર કરાવી શકાશે અને એ રીતે બેકારીનો પ્રશ્ન આંશિક રીતે હલ કરી શકાશે. જોકે રિસેસમાં ઊંઘતા કર્મચારીઓ-અધિકારીઓને જગાડવા માટે નિયુક્ત થયેલા કર્મચારીઓ પોતે ઊંઘી ન જાય એની તકેદારી રાખવી પડશે. (અલબત્ત, આ કર્મચારીઓને ઊંઘવા માટે પણ કોઈ જુદો સમય ફાળવવો પડશે.) ફિલ્મ ‘અમરપ્રેમ’માં એક ગીત આવે છે, એની એક કરી નીચે મુજબ છે :

મજધાર મેં નેયા તોલે તો માંજી પાર લગાયે...

માંજી જો નાવ તુબોયે ઉસે કૌન બચાયે ?

એ રીતે :

કર્મચારી જે સૂએ, પટાવાળા એને જગાડે,

પટાવાળા પણ સૂઈ જાયે એને કોણ જગાડે ? – એવું થાય.

અમારા એક ભિત્રને ખરેખર આવું થયેલું. તેઓના એક બોસ હતા (‘હતા’ એટલા માટે કે હવે નથી.) બોસ પોતે બપોરે સૂતા નહિ ને બીજાંને સૂવા દેતા નહિ, એટલે તેઓ જાણું જ્યા નહિ, એમ અમારા ભિત્ર માને છે. આ બોસ રિસેસ સિવાય ગમે તે સમયે સુપરવિઝનમાં નીકળતા. એટલે એમના હાથ નીચેના કર્મચારીઓ-અધિકારીઓ બપોરે ઓફિસમાં નિરાંતે સૂઈ શકતા નહિ. અમારા ભિત્રે એક યુક્તિ કરી. એમની ડેબિન બરાબર બોસની ડેબિનની સામે જ હતી. એટલે પટાવાળાને દરરોજ બે વાર ચા પાવાની અને અઠવાયિ એક વાર નાસ્તો કરાવવાનો એ શરતે, સાહેબ ડેબિનમાંથી નીકળતા દેખાય કે તરત જ મને જગાડી દેવાનો એવું અભૂતપૂર્વ આયોજન કરેલું. પટાવાળાભાઈ એમની ડેબિનની બહાર ટેબલ પર બેઠા હોય ને અમારા ભિત્ર ઊંઘતા હોય. પણ એમાં એક વાર ગોટાઓ થયો. સાહેબ, બહાર નીકળ્યા એ વખતે પેલા પટાવાળાભાઈ પોતે જ ઊંઘી ગયા હતા ! ભિત્રની ડેબિન પાસે સાહેબ આવ્યા એ વખતે પટાવાળાજ નસકોરાં બોલાવતા હતા ! પટાવાળાને ઊંઘતો જોઈને અને એનાં નસકોરાં સાંભળીને સાહેબનો પિતો ગયો. એમણે જોરજોરથી ઘાંટા પાડ્યા. સાહેબના ઘાંટા સાંભળી ભિત્ર પટાવાળાથીય પહેલાં જાગી ગયા ને આંખો ચોળતા બહાર આવ્યા. બહારનું દશ જોઈ ઉઘાઈ ગયા. સાહેબે એમને જ બપોરે ચાલુ ઓફિસ ઊંઘવા માટે પટાવાળાને મેમો આપવાનું ફરમાન કર્યું. ભિત્રે દુઃખી હૃદયે એ કર્તવ્ય બજાવ્યું. પણ પછી એમણે આ જોખમી આયોજન પડતું મૂક્યું.

મેં પચીસ વર્ષ સરકારી નોકરી કરી. આ સમયગાળામાં ઓફિસમાં હું ક્યારેય ઊંઘ્યો તો નથી જ, પણ જોકાંય નથી ખાધાં. આ કારણે મારી નિષ્ઠા વિશે ઊંચો અભિપ્રાય બાંધવાની જરૂર નથી. મારે કબૂલ કરવું જોઈએ કે ચાલુ ઓફિસે સૂવા માટે જે હિંમત જોઈએ અને માનસિક સ્વસ્થતા જોઈએ એનો મારામાં સદંતર અભાવ હતો. પરંતુ

બપોરે સૂવાનું આકર્ષણ મારામાં વર્ષોથી પ્રબળપણે રહેલું છે. એટલે રજાના દિવસે બપોરે ‘સર્વ ધર્માનું પરિત્યજ્ય’ ઉંઘને શરણો જતો. અને તેથી જ નિવૃત્ત થવાનો વખત આવ્યો અને લોકો પૂછવા લાગ્યા : ‘નિવૃત્ત થઈને શું કરશો ?’ ત્યારે સૌને હું એક જ જવાબ આપતો : ‘બીજું શું એની ખબર નથી, પણ બપોરે ઉંઘિશ એ નક્કી.’

પરંતુ, નિવૃત્ત થયા પછી ઘ્યાલ આવ્યો કે બપોરે સૂવાનું સહેલું નથી. બપોરે એક વાગ્યે સૂવું અને ત્રણ વાગ્યે ઊર્ધ્વાં, આવું ટાઈમટેબલ મેં ગોઠવ્યું. પણ અઠવાડિયાના સાતમાંથી ચાર દિવસ તો આ જ સમયગાળામાં ટેલિફોનની વંટડી અચૂક વાગે. એમાંથી એકાદ રોગ નંબર હોય જ. અમારો અત્યારનો ફોન નંબર છે એ પહેલાં કોઈ સુરેશભાઈનો હતો. આ સુરેશભાઈ દિવસે એકથી ત્રણના સમયગાળામાં જ ઘેર મળતા હશે એમ એમના પર આવતા ફોન પરથી મને લાગ્યું. પહેલાં તો આ સમયગાળામાં રોજના પાંચ-છ ફોન સુરેશભાઈ માટે આવતા. પછી સંઘા તો ઘટતી ગઈ પણ તોય અઠવાડિયાનો એકાદ ફોન તો લાંબા સમય સુધી આવતો રહ્યો. હું નામતાથી કહું કે આ નંબર હવે સુરેશભાઈનો નથી. તો તરત જ પ્રશ્ન પુછાયા : સુરેશભાઈનો શું નંબર છે ? હું કહું કે ખબર નથી. તો મોટા ભાગના ‘સારું’ કહી ફોન મૂકી દેતા, પણ કોઈ કોઈ ગુસ્સે પણ થઈ જતા : ‘સુરેશભાઈનો નંબર લઈને બેઠા છો ને પછી એનો નવો નંબર કરો તે જાણતા નથી ? કેવા માણસ છો તમે !’ સુરેશભાઈનો નંબર ન જાણવા માટે હું એમની માફી માગતો, પણ તોય તેઓ ગુસ્સો કરીને રિસીવર પછાડીને જ મૂક્તા.

આજે પણ અઠવાડિયામાં એકાદ-બે દિવસ કોઈ પરિચિત (અને બપોરના મારા સૂવાના સમયથી અપરિચિત) વ્યક્તિ બેલ મારે છે. હું ઊઠીને બારણું ખોલું છું. જ્ઞાણે આ સમય સૂવાને બદલે હાર્મોનિયમ વગાડવાનો હોય એવી રીતે પૂછે છે : ‘સૂતા’તા ?’ હું હા પાહું એટલે તેઓને થોડો ક્ષોભ થાય પણ આવી જ ગયા પછી શું થાય ? કેટલાક કોઈ કામસર આ સમયે બપોરની ઊંઘ પર આકમણ કરે છે, તો કોઈ તો ‘આ બાજુ નીકળ્યો’તો તો થયું કે હવે તો તમે ઘરે જ હો છો તો ચાલો મળીએ.’ એ રીતે આવી ચેત છે. નિર્હેતુક પ્રેમ ઊંચી ચીજ ગણાય છે, પણ મારી ઊંઘનો ભોગ લેવાયો હોય છે એટલે હું આ ઊંચી પ્રેમસગાઈની કદર કરી શકતો નથી. જોકે એમને તો એમ જ કહું છું : ‘સારું કર્યું ને !’ (એમણે બિલકુલ સારું કર્યું ન હોવા છતાં.)

અઠવાડિયામાં બે-ત્રણ વાર એવું પણ બને છે કે બેલ વાગે છે, હું આંખો ચોળતો બારણું ખોલું છું. સામે કોઈ તદન અપરિચિત વ્યક્તિ ઊભી હોય છે. કોઈ વાર પૂછે છે : ‘ભાઈલાલભાઈ અહીં રહે છે ?’ કોઈ વાર ‘આ રાજુભાઈનું ઘર છે ?’ એમ પૂછે છે તો કોઈ વાર મહાસુખભાઈ કે કાંતિભાઈ વિશે પૂછે છે. હું ના કહું છું ને કહું છું કે અહીં હું રહું છું ને મારું નામ રતિભાઈ છે તો આવનાર જેનું નામ હોય તેના એટલે કે ભાઈલાલભાઈના કે રાજુભાઈના કે મહાસુખભાઈના કે કાંતિભાઈના ફ્લેટનો નંબર કયો છે એવો પૂરક પ્રશ્ન કરે છે. મને મારા ફ્લેટનો નંબર પણ જલદી યાદ આવતો નથી, તો પડેશીના ફ્લેટનો નંબર યાદ હોવાનો તો પ્રશ્ન જ નથી. એટલે હું એ

અજનબી સાથે ઉપર કે નીચે જઈ મારા જે-તે પડોશીનો ફ્લેટ બતાવું છું. આવું મારે જ બને છે કે મારા બીજા પડોશીઓને પણ બને છે એ વિશે મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે, અજાણી વ્યક્તિઓ કેવળ મારું બારણું જ ખખડાવે છે ! ‘અહીં કોઈ પણ વ્યક્તિને જેનું કામ હોવો તેનો ફ્લેટ શોધી આપવામાં આવશે,’ એવું પાટિયું મારા બારણા પર માર્યું ન હોવા છતાં અજાણી વ્યક્તિઓ મારા ફ્લેટનો જ બેલ કેમ વગાડે છે એ રહસ્ય હું ઉકેલી શકતો નથી. તત્ત્વજ્ઞાનીઓ વિધિનું નિર્માણ કે ઋણાનુંથી કહે છે તે આ જ હશે ?

મારે ત્યાં ટપાલો વધારે પ્રમાણમાં આવે છે. સામાન્ય ટપાલો તો ટપાલ માટેના કાણામાંથી પોસ્ટમેન સરકાવી દે છે, પણ મેગેજિનો એ કાણામાં આવે નહિ. એટલે મહિનાના પહેલા પંદર દિવસમાં પાંચ-સાત વાર સાહિત્યપ્રેરિતિને કારણે હું બપોરના સૂર્ય શકતો નથી. દરેક વખતે મેગેજિનો બંધ કરવાનો વિચાર આવી જાય છે. આ વિચાર મેં અમલમાં નથી મૂક્યો પણ આપણાં મેગેજિનોની ગ્રાહકની સંખ્યા ઘટતી જાય છે એનું કારણ આવું તો કંઈ નથી ને, એની તપાસ મેગેજિનોના તંત્રીઓએ કરવી જોઈએ.

જગતને મારે દિવ્ય સંદેશ આપવાનો છે : ‘બપોરે સૂર્યો, નિરાંતે સૂર્યો, તમારા ભાગ્યમાં બપોરે સૂવાનું ન લખ્યું હોય તોપણ બીજાઓને તો સૂવા જ દો.’

— રત્નિલાલ બોરીસાગર

માતૃભાષા ગુજરાતીના શિક્ષણમાં થતા નવતર પ્રયોગોનું અભિવાદન

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ વિશ્વકોશની રચના કરી. એ પછી અન્ય કોશો તથા ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. આની સાથોસાથ માતૃભાષા ગુજરાતીના સંવર્ધન માટે; વિદ્યાર્થી, યુવાનો અને જનસમાજમાં ગુજરાતી ભાષા અને શિક્ષણ અંગેની સજજતા વધે, તેવા મૂળગામી પ્રકલ્પો પણ હાથ ધર્યા છે. એ સંદર્ભમાં આ માટે બાળકો સાથે જીવંત સંપર્ક ધરાવતા અને બાળકોને માતૃભાષા ગુજરાતી પ્રત્યે અભિમુખ કરવા વિવિધ પ્રયોગો કરતા શિક્ષકોને વિશ્વકોશ ટ્રસ્ટ નિર્માણ આપે છે. વિદ્યાર્થીઓમાં માતૃભાષાની સજજતા વધે; ઉચ્ચાર, જોડણી અને લેખનમાં વિશેષ ક્ષમતા કેળવાય તેવા પ્રયોગો કરનારા શિક્ષકો પોતાના આ પ્રયોગો અંગે વિશ્વકોશને વિગતે જણાવે. આ પ્રયોગો સંદર્ભ વિશ્વકોશ ટ્રસ્ટની તજ્જ્ઞ સમિતિ ઉત્તમ ગ્રાન્ટ પ્રયત્નો તારવશે, જેમનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સંમાન કરશે. વળી, વિશ્વકોશ ટ્રસ્ટ શિક્ષકોના આવા પ્રયત્નો અને પ્રયોગો વ્યાપક જનસમાજ સુધી પહોંચે અને તેનું યોગ્ય અભિવાદન થઈ શકે તેમાં રસ ધરાવે છે. આવા અનુકરણીય પ્રયોગોને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સામયિક ‘વિશ્વવિહાર’માં પ્રસિદ્ધ કરાશે.

આપનો પ્રતિભાવ ૨૫ માર્ચ, ૨૦૨૨ સુધીમાં મોકલી આપવા વિનંતી.

સરનામું : રાજ્ય મહેતા, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ૫૧/૨, રમેશપાર્ક, બંધુસમાજ સોસાયટી સામે, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩



કરુણાને એક અવસર તો આપો !

મે-જૂન મહિનામાં ૧૨ જિલ્લાનાં ૧૮ જેટલાં કેન્દ્રો પર વિશ્વગ્રામ અને સ્વપથ ટ્રસ્ટના ભિત્રો કોરોનાના દર્દાઓને મેડિકલ સહયોગ પૂરો પાડી રહ્યા હતા અને મારા પર ફોન આવી રહ્યા હતા કે, ‘સંજ્યભાઈ, એક દીકરીએ મા ગુમાવી છે, એક દીકરા-દીકરીએ મા-બાપ બંને ગુમાવ્યાં છે તો એમને માટે શું કરી શકાય?’ એ ગરમ દિવસોની એક ગમગ્નિન રાત્રીએ મારા ઓરડામાં જગાજિતસિંહની ગજલમાંથી દર્દ કણસી રહ્યું હતું... ‘ભૂખે બચ્ચોં કી તસલ્લી કે લિએ માં ને ફિર સે પાની પકાયા દેર તક !’ અને ભરાઈ આવેલા હૃદયથી છલકાઈ ઉઠેલી મારી આંખો બોલી કે, કોરોનામાં જે બાળકની મા પણ ન રહી હોય, બાપ પણ ન રહ્યો હોય, અને તસલ્લી કોણ આપશે ?

અને વિશ્વગ્રામના કલ્યાણભિત્રો દ્વારા આવાં દીકરા-દીકરીઓની માહિતી એકઠી કરવાનું આપણે શરૂ કર્યું. એકાદ મહિનાથી પણ ઓછા સમયમાં આપણી પાસે ૧૬૦૦થી પણ વધુ નામો આવ્યાં અને આપણે ચોકી ઉઠ્યા કે આપણે તો આપણા સીમિત ઝોતો દ્વારા જ આ માહિતી એકઠી કરી છે, તોપણ આટલો મોટો આંકડો છે તો વાસ્તવમાં તો આ સંખ્યા કેટલી હશે ?

કામના બીજા તબક્કામાં આ માહિતીને આધારે આપણે એમના ઘરે ઘરે જવાનું ને એમને મળવાનું અને હુંફ આપવાનું શરૂ કર્યું. ૧૨૦૦ કુંભોનાં એ આંગણાંઓ, એ ઘરો, એ લોકો, એ ચહેરાઓ અને એ આંખો સુધી પહોંચવાનો એ ઉપકમ આપણા સંઘા ભિત્રો માટે એમના અંતરને ઢંગેળનારો બની રહ્યો છે એવું મને એમની સાથેની રોજ રોજ થતી ટેલિફોનિક વાતોથી અનુભવાતું ! ઘણા કલ્યાણભિત્રો તો વાત કરતાં જ રડી પડતા તો ઘણાને લાગતું કે કદાચ હવે એ વધારે ઘરે જશે તો પાગલ થઈ જશે ! તો ઘણાને પોતાની આટલી નજીકની ગરીબી પહેલી વખત દેખાઈ. શાઈનિગ ઈન્ડિયા અને વાઈબ્રાન્ટ ગુજરાતનાં સ્લોગનોની વચાળે આપણે કેટલા અમાનવીય થઈ ગયા છીએ ! ઈન્ડિયાના લોકોની આ ભારતયાત્રા દરમિયાન બીજા કેટલાક મુદ્દાઓ પણ નજર સામે આવ્યા : (૧) લગભગ ૮૦ ટકા પરિવારોમાં મૃત્યુ એ પુરુષ સભ્યનું હતું તેથી આ સંઘાં ઘરોની આવક અટકી ગઈ હતી. એક પરિવારમાં મૃત્યુ પામેલો બાપ ઝાઈવરી કરતો હતો ને પાંચ દીકરીઓને મૂકીને મર્યાદ હતો, મોટી દીકરી પાંચમા ધોરણમાં હતી અને નાની દીકરી પાંચ મહિનાની. આ પાંચ દીકરીઓની માને મજૂરી કરવા પણ જવું હોય તો કેમ કરીને જાય ? (૨) વિધવા થયેલી આ બહેનોની સરેરાશ ઉંમર ઉપર વર્ષ જેવી છે. ૨૦૧૩ની કેદાર આપદા વેળા લગભગ ૫૮ જેટલી વિધવા બહેનોને આપણે ૫૦-૫૦ હજારની F.D. કરાવી આપેલી, એ દિવસનું સ્નેહમિલન

અને સાથે સાથે આ વિધવા બહેનો પર એમના જ સગા જે નજરોથી જોતા હતા એને લઈને એમનું દર્દ પણ અત્યારે દશ્ય બની મારી સામે દોરી રહ્યું છે ! (ત) આમાંના ૭૦ ટકાથી પણ વધુ પરિવારો આર્થિક અને સામાજિક વંચિત વર્ગમાંથી હતા.

આ સંઘળી પ્રક્રિયાના અંતે વિશ્વગ્રામના સૌ કલ્યાણમિત્રો અને અમારા વરીલમિત્રો એવા સ્વપથ ટ્રસ્ટનાં રાજેશભાઈ-સંધ્યાબહેન ભડે સાથે મળીને આમાંનાં ૬૦૦ ફેટલાં દીકરા-દીકરીઓની નાનીશી જવાબદારી સ્વીકારવાનો સંકલ્ય કર્યો અને પ્રાથમિક શિક્ષણ લેતા બાળકને વર્ષના ૬૦૦૦ રૂપિયા, માધ્યમિક શિક્ષણ લેતા બાળકને વર્ષના ૮૦૦૦ રૂપિયા, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લેતા બાળકને ૧૦,૦૦૦ રૂપિયા અને ઉચ્ચ-શિક્ષણમાં ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ હજાર રૂપિયાનો શૈક્ષણિક સહયોગ આપણે પહેલા તબક્કામાં ગ્રાશ વર્ષ માટે અને બીજા તબક્કામાં એ પછીનાં બે વર્ષ માટે કરીશું એવું નક્કી કર્યું.

ત્રીજા તબક્કાના કામમાં આપણે એમના ધરે ધરે જઈને ઓછામાં ઓછી છતાં જરૂરી એવી બધી વિગતો મેળવીને ફોર્મ ભરવાનું શરૂ કર્યું અને સાથે સાથે વિશ્વગ્રામના સૌ કલ્યાણમિત્રો આ બાળકોના મેન્ટર પણ બનવા લાગ્યા, અલબત્ત આ મેન્ટરશિપની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ગોઠવતાં-બનતાં થોડોક સમય લાગશે પણ અત્યારે આ મેન્ટર આ બાળકના જીવંત સંપર્કમાં રહેશે અને વર્ષમાં ઓછામાં ઓછા ગ્રાશ વખત ધરની મુલાકાત અને ગ્રાશ વખત એની શાળાની મુલાકાત લેશે. વાસ્તવમાં તો આંશિક સહયોગને નિમિત્ત બનાવીને કરવાનું ખરું કામ તો એ જ છે કે જેના થકી આપણે કહેવાતા પારકાને સાચા અર્થમાં પોતાના કરી શકીએ.

સાથે જુદાં જુદાં વાર્તાલાપો-શિબિરો-પ્રવાસો-વર્કશૉપ-વાંચન થકી આ બાળકો સાથે જુદી જુદી સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા એમના સમગ્ર જીવનને સ્પર્શવાની પણ આપડી અંતરની દૃઢા છે. જેમાં કચ્છનો ધરતીકંપ, ૨૦૦૨નાં કોમી તોફાનો, ૨૦૦૪નું ત્સુનામી, ૨૦૦૫નો કાશમીર ધરતીકંપ, ૨૦૦૮નું કોશી-પૂર (બિહાર), ૨૦૧૨નાં આસામનાં કોમી તોફાનો, ૨૦૧૩ની કેદાર આપદા, ૨૦૧૫નો નેપાળનો ભૂકંપ તથા ૨૦૧૭થી કાશમીરનાં બાળકો સાથે ચાલી રહેલું કામ, આ સંઘણાં કામોના અનુભવને આધારે આપણે આ કામ કરીશું એવી શ્રદ્ધા છે.

૧૦ ઓક્ટોબરથી શરૂ કરીને ૧૨ ડિસેમ્બર સુધીના સમયગાળામાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસૂણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, તાપી, સૂરત, ડાંગ, રાજકોટ – આમ આ ૧૦ જિલ્લામાંથી મોટા ભાગના જિલ્લાઓમાં સ્નેહમિલન થોળીને આપણે પણ પણ પણ વધુ દીકરા-દીકરીઓને આ વરસનો સ્નેહ-સહયોગ આપી દીધો છે. આ સ્નેહમિલનમાં આ બાળકો, એમનાં મા-બાપ, એમના મેન્ટર અને બીજા સાથી-વરીલો એકઠાં થાય છે, એકમેકને મળવાનું થાય છે, વાતો થાય છે, પરિચય વધારે પાકો થાય છે, સૌ સાથે જેમે છે અને ભાવપૂર્વક ફરી મળવાનું નક્કી કરી છૂટા પડે છે.

– સંજયનુલા



હાઈડલબર્ગમાં મળેલાં આશ્રય

હાઈડલબર્ગની વાટ પકડી, ત્યારે મનમાં ભરપૂર અહોભાવ, અત્યંત વિસ્મય અને ભારોભાર ઉત્સુકતા હતી. હાઈડલબર્ગ એટલે બુદ્ધિજીવીઓની નગરી. જર્મનીનું આ સૌથી પુરાણું વિદ્યાધામ છે. છેક ઈ. સ. ૧૩૮૬માં અહીં જર્મનીની સૌથી પહેલી યુનિવર્સિટી સ્થપાઈ. આ યુનિવર્સિટીએ આઈ આઈ નોબેલવિજેતા વૈજ્ઞાનિકો આપ્યા, જેમાંથી ત્રણ તો વળી મેડિકલ ડૉક્ટર હતા ! આ યુનિવર્સિટીએ એવા કવિઓ આપ્યા, જેમણે અંગેજ સાહિત્યમાં પ્રાણયભાવની રંગદર્શિતાનો યુગ - ‘રોમેન્ટિસિઝમ એરા’નું મંડાણ કર્યું. આ શહેરથી આકાર્ષિતને અહીં આવી વસેલા અનેક ગંભીર ચિંતકો અને કવિઓ જેવા કે, ગટે, બ્રાન્ટેનો, કેલર, માર્ક ટ્રેવેલ્ન, કાર્લ મારિયા, વોન વેબર, એલન જિન્સબર્ગ - એ સૌની માનીતી ફિલોસોફર્સ વોક નામની પગદરી અહીં છે, જે યુરોપની સૌથી સૌંદર્યમયી કેડી તરીકે મશહૂર છે. કેટકેટલી અહોભાવપ્રેરક વાતો સાંભળી હતી, એ શહેર વિશે !

નેકાર નદીના ખીણપ્રદેશમાં વસેલી વિદ્યાનગરીની આ રૂપકરી વસાહત. શહેરની ધાંધલધમાલ અહીં નથી. હાઈડલબર્ગ સાવ ગામડા જેવું તો નહીં, પણ આપણા કોઈ કસ્બા જેવું લાગે. એની આજુબાજુ પર્વતો વચ્ચેથી વહી આવતી નેકાર નદી, ખીણમાં છલકતી વનરાજી, ઢોળાવો પર છવાયેલી દ્રાક્ષની મંડપલતાઓ - એવી બધી નયનરમ્ય સામગ્રી મળીને અહીં શાંત છતાં જીવત વાતાવરણ રચે છે. નેકાર ઉપરનો સદીઓ પુરાણો પુલ કોઈ રૂપગર્વિતા જેવો લાવણ્યમય છે. એના પર ચાલતાં હોઈએ ત્યારે ચહેરાને સ્પર્શતી હવાઓ નેકારની પેલે પારની પર્વતમાળા વચ્ચે વસેલી દુનિયાની ગાથાઓ કહેતી હોય તેવું લાગે. શહેરને માથે જળબુઝતા હરિયાળા કુંગરો વચ્ચે નીલપરીની દંતપંક્તિ જેવો હાઈડલબર્ગનો કિલ્લો દેખાય છે.

પગથિયાં ચચતાં અમે કિલ્લા પર પહોંચ્યાં. ૧૩૮૩ સદીમાં બંધાયેલો એ કિલ્લો જર્જરિત હતો. એમાં ખાસ કોઈ નકશીકામ કે વિરાટમાંથી ઉપસતી ભવ્યતાનાં દર્શન પણ ન થયાં, પણ તળેટીમાં વસેલું ગામ અને નટખટ નેકાર - બંને એની ઊંચાઈ પરથી મનોહરી લાગતાં હતાં. કિલ્લાની અંદર ઓછો હેત્રી બિલિંગ નામની એક ઈમારત જોઈને અટકી જવાયું. એના નીચલા માળે એપોથેકરી ઘૂઝિયમ હતું. અમારા માટે વિસ્મયભર્યા આનંદની બાબત એ હતી કે, એ એક ફાર્મસી અને ડિસ્પેન્સરીનું સંગ્રહાલય હતું ! ત્યાં ફાર્મસીનો અને ડિસ્પેન્સરીઓનો ઈતિહાસ સંગ્રહાયેલો જોવા મળ્યો. ચિકિત્સાશાસ્ત્રના શરૂઆતના દિવસો, જ્યારે ચૂલ્હા પર મૂકેલા લોંડંડના મોટા તાવડામાં ઉકાળીને દવાઓ બનાવવામાં આવતી તે સમયનાં, લેબોરેટરીનાં



હાઈડ્લબર્ગ ચિજ

ઓછાં ને રસોડાનાં વધારે લાગે તેવાં ઉપકરણોના અસલ નમૂના જોવાનો લહાવો અન્તાયાસ મળી ગયો.

પુરાણા સમયની ફાર્મેકોપિયા અને સંશોધનોનાં તારણો દર્શાવતી હસ્તપ્રતો ઉપરાંત આજે તો સાવ કાચો માલ લાગે તેવી, ૧૭થી ૧૮મી સદી વચ્ચે વપરાતી દવાઓના હજાર જેટલા નમૂના પણ સંગ્રહાયેલા જોયા. એ સમયની ચિકિત્સકની ચેમ્બર, એની ખુરશી પાછળ આખી ભીતિ રોકતો, ઘણાંબધાં ખાનાંવાઓ દવાઓ રાખવાનો કબાટ, પ્રવાહી દવાઓ રાખવાની બાટલીઓ, એનાં લેબલ, દવાનો પાઉડર તોલવાનાં સાવ નાનકડાં જાજવાં, દવા વાટવાના ખલદસ્તા જોયા. અરે ! પણ પણ જેને જોઈને ડરથી ભાગી જાય તેવી, ધ્યાની મસમોટી ઈજેક્શન-સિરિઝો, સ્ટેથોસ્કોપને સ્થાને વપરાતાં મોટાં મોટાં ભૂંગળાં, ડોક્ટરના ઝગળા - આ બધું જોવાની મજા પડી ગઈ. સાથે સાથે સાવ ટાંચાં સાધનોની મદદથી પણ નિષાભરી સેવાભાવનાથી દરદીઓની પીડા હરવાનો પ્રયત્ન કરનાર ચિકિત્સાવિજ્ઞાનના એ પૂર્વજી પ્રત્યે અહોભાવથી માણું નમી ગયું. અમારા જીવનમાં એ ઉદાત પરંપરાની ધરોહર વહન કરવાનું જે સદ્ગ્રામી પ્રાપ્ત થયું છે, તેની ઉપકૃતતા અનુભવતાં અમે આગળ ચાલ્યાં. નદી ઓંંગિને અમે સર્જકો ને ચિત્તકોની માનીતી વિશ્વવિદ્યાત 'ફિલોસોફર્સ વોક' પર ચાલવા ગયાં. આ નન્યનરભ્ય વોક-વે પર ચાલતી વખતે ગામના ને કિલ્વાના પરિપ્રેક્ષમાં ઊભરતી નેકારની વિવિધ મુદ્રાઓ જોતાં મન જાણે ધરાયું જ નહીં !

ફિલોસોફર્સ વોક પર ચાલીને આવ્યા પછી, અમે વિચાર્યુ કે, બસસ્ટેન્ડ પર જે પહેલી આવે તે બસમાં બેસી જવું. બસનો રૂટ પૂરો થાય ત્યાં સુધી આંટો મારીને પછી જ્યાં હોઈએ ત્યાંથી રેલવેસ્ટેશનની બસ પકડીને પાછાં ફરવું, જેથી સમગ્ર વિસ્તારની જલક પામી શકાય. નદીને પેલે પારથી તરત જ એક બસ મળી પણ ગઈ. બસ કયાંની છે,

તेनो ખ્યાલ નકશો જોતાં ન આવ્યો. હાથમાં આખા દિવસનો હાઈડલબર્ગ સિટીપાસ હતો, એટલે ટિકિટ તો કઠાવવાની નહોતી. બસ તો ચાલી ગામ છોડીને ટેકરી તરફ. અમારો રસ્તો ઘનધોર વનમાંથી પસાર થવા લાગ્યો. વચ્ચે વચ્ચે ઘરોનાં નાનાં જૂમખાં આવે, ને પછી ઊંચાં ઊંચાં વૃક્ષોથી છવાયેલા ઢોળાવો દેખાય. આ ઢોળાવો પર પણ છૂટાંછવાયાં મફાનો હતાં. પુષ્પમંજિત બારીઓ ને અટારીઓથી શોભતાં આ અત્યંત સુંદર મફાનોમાંથી ઘણાંખરાંની બાજુને કે પાછળ તરણકુંડ હતા. બસ, એક રૂપકું ઘર હોય ને આસપાસ અનવરત અરણ્ય. અરે ! આ તો એ જગ્યાએ અક્સમાત પહોંચી જવાયું, જ્યાં વિશ્વસાહિત્યના ધુરંધરો રહી ગયા અને આજે પણ કેટલાક રહે છે. ફૂલક્યારીઓથી છલોછલ ગેલરીમાં બેસીને લખવાનું ને સામે નાખી નજર પહોંચે ત્યાં સુધી ઘનધોર વન - અહીં રહેનારને કવિતા કેમ ન સ્ફુરે ? કેમ ન રચાય વિશ્વનું શ્રેષ્ઠ સાહિત્ય અહીં ? પર્વતની વચ્ચે વસેલાં આ ઘરો વિશે વાંચેલું, પણ સ્વખેય કલ્યના નહીં કે એક વાર એની હવાઓને શ્વસવા મળશે ! જેમની ભાષા કે નામ પણ હું જાણતી નથી, તેવા જર્મન લેખકો અને કવિઓના વિચાર મનમાં ધૂમરાવા લાગ્યા.

આસપાસના વાતાવરણમાં એટલાં તો લયદીન થઈ જવાયું કે, ખ્યાલ પણ ન રહ્યો કે, અમે ગામથી પચીસેક ડિલોમીટર દૂર આવી ગયાં હતાં અને બસ હવે ખાલી થઈ ગઈ હતી ! યુરોપની બસોમાં કન્ડક્ટર હોતા નથી, ડ્રાઇવર પોતે બસસ્ટોપ આવતાં અમારી પાસે આવી પૂછવા લાગ્યો, ‘તમારે જવું છે ક્યાં ?’ અમે કહ્યું, ‘ક્યાંય નહીં, પ્રવાસી છીએ, તમારો વિસ્તાર જોવો હતો, અહીંથી હવે સ્ટેશને પાછાં ફરીશું.’ ડ્રાઇવરનો ચહેરો ગંભીર થઈ ગયો. - એ કહેવા લાગ્યા, ‘આ બસ તો અહીં પૂરી થાય છે, ને આ એવી જગ્યા છે, જ્યાં દિવસમાં બહુ ઓછી બસો આવતી હોય છે. તમે પકડી એ આ તરફ આવતી છેલ્લી બસ હતી.’ અમે મુંજાયાં. આસપાસ નજર કરતાં ખ્યાલ આવ્યો કે, હજુ તો સાંજ ટળતી જ હતી, તેવામાં તો આખું ગામહું સૂમસામ થઈ ગયું હતું. અમારી મૂંજવણ પારખી જઈ એમણે કહ્યું, ‘હું એક રીતે તમને મદદ કરી શકું. હમણાં તમે બસમાંથી ઉત્તરી જાવ. હું બસને લઈને તેપોમાં જાઉં છું. બરાબર ત્રીસ મિનિટ પછી હું બસ લઈને પાછો ફરીશા, પે...લું સામે દેખાય છે ને, તે બસસ્ટેન્ડ પર. તમે ત્યાં જ ઉત્તમાં રહેજો, ભૂત્યા વિના. જોજો તમે ન દેખાયાં તો મારાથી થોભી નહીં શકાય. આ ઉતારુઓ માટેનો ફેરો નથી. અને યાદ રાખજો, મુખ્ય શહેર તરફ જતો આજની તારીખનો એ છેલ્લો ફેરો હશે અને આ ગામમાં કોઈ હોટેલ નથી.

અમારા જીવમાં જીવ આવ્યો. સૂમસામ ગામહું રૂપાયું લાગવા લાગ્યું. સૂચના મુજબ અમે બસમાં ચચ્ચાં ત્યારે ડ્રાઇવરમહાશયના ચહેરા પર મૈત્રીભાવ જણકી રહ્યો હતો. એ ભલા માણસે નેકારના નદીકિનારે અમને ઉતાર્યા ત્યારે કિલ્લો રોશનીથી જળહળતો હતો અને હાઈડલબર્ગની ગલીઓ ઝાકમજાળ હતી.

- ભારતી રાણે



સ્થાપત્યમાં બિંદુ

કળાના પ્રત્યેક પ્રકારમાં તેનાં વિવિધ અંગો પરસ્પર સંકળાયેલાં હોય છે. આ અંગો એક રીતે જોતાં પોતાની વાત તો કહેતાં જ હોય છે, પણ સાથે સાથે તેમનો સમૂહ પણ એક વિશેષ સંદર્ભો આપતો હોય છે. સમગ્રતામાં કળાએ કઈ વાત કરવાની છે, તેના આધારે તેનાં અંગો તથા તેની ગોઠવણ નક્કી કરાતી હોય છે. ઘણી વાર આ અંગો-કળાના ઘટકોની પસંદગી તથા તેની ગોઠવણ પરથી જ કળાનો પ્રકાર નિર્ધારિત થાય છે. ગ્રીક સ્થાપત્યમાં થાંબલો, તેની ઉપરનો મોભ, નીચેની પ્લીન્થ - મંચની બનાવટ, ઉપરનો ત્રિકોણાકાર છાતનો ભાગ : આ બધાંની રચના તથા ગોઠવણથી તે ડોરીક કે આયોનિક કે અન્ય શૈલીનું મકાન છે તે નિર્ધારિત થતું.

સંગીતમાં જેમ સ્વરની પસંદગી મહત્વની બને છે તેમ સ્થાપત્યમાં અંગોની પસંદગી મહત્વની બની રહે છે. આ અંગો ભૌતિક પણ હોઈ શકે અને વૈચારિક-પ્રત્યાત્મક પણ હોઈ શકે. સ્વરોના સમૂહથી સંગીત સર્જતું હોય છે તેમ સ્થાપત્યમાં તેનાં અંગોની ગોઠવણ કરાતી હોય છે. આ અંગોની અસર તેનો પ્રકાર, તેની બનાવટ અને તે માટે વપરાતી સામગ્રી, તેનું સ્થાન તથા ગોઠવણ, તેનો આકાર, તેનું માપ તથા તેમાં જળાયેલ પ્રમાણ, તેની બાબ્ય સપાટીનું વિગતીકરણ, તેનો રંગ તથા બરછતા અને તે ઉપરાંત જે તે પૃષ્ઠભૂમિમાં તેની સાંસ્કૃતિક યથાર્થતા મહત્વની બની રહે છે.

ભૌતિકતાના સંદર્ભમાં સ્થાપત્યનાં અંગોમાં સંભ, દીવાલ, મોભ, પગથિયાં, મેચ વગેરે રચનાઓનો સમાવેશ થાય જ્યારે વૈચારિક અંગોમાં બિંદુ, રેખા, સપાટી, અવકાશ જેવી બાબતોનો ઉત્લેખ થાય છે. આ ઉપરાંત સ્થાપત્યનાં અંગોની ગોઠવણમાં લયબદ્ધતા, મહત્ત્વ, વિરોધાભાસ, સમભિતિયા જેવા સિદ્ધાંતોની વાત થાય.



ગુંબજ નીચે સ્થપાતું મહત્વનું કેન્દ્ર



પ્રાંગણમાં આવેલ સંભથી સ્થપાયેલ બિંદુથી તે સ્થાનનું વધતું મહત્વ

કળાના કોઈ પણ અંગનું અર્થપૂર્વકનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. તે છતાં પણ સ્થાપત્યમાં બિંદુને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર અંગ ગણવામાં આવે છે. બિંદુ જ એક એવું અંગ છે જેનું ગ્રાણેય અક્ષમાં માપ નહિવત્ - શૂન્ય સમાન છે, છતાં સ્થાપત્યમાં તેની રચના સંભવિત થાય તે માટે તેને માપ અપાય છે. આમ તો બિંદુનો આકાર ન હોય તેમ છતાં પ્રતીકાત્મક સ્વરૂપે તેને ગોળાકાર મનાય છે. જોકે સ્થાપત્યમાં ચોરસ તથા ઘટ્કોણીય બિંદુઓ પણ પ્રયોજયાં છે. આવાં બિંદુ થોડાં વિસ્તૃત પણ હોઈ શકે.

સ્થાપત્યમાં એકલા પ્રયોજયેલા સંભથી બિંદુ સ્થપાઈ શકે. સાથે સાથે ગુંબજની નીચેના સ્થાને કેન્દ્રમાં બિંદુ આપમેળે ઊભરી આવે. ગોળાકાર કક્ષના કેન્દ્રમાં પણ આવી જ રીતે બિંદુની પ્રતીતિ થાય. આવાં બિંદુ ભૌતિક સ્વરૂપે નહિ પણ વૈચારિકતામાં વર્તાતાં હોય છે. શંકુ કે પિરામિડના શિખરે પણ બિંદુ સ્થાપિત થાય છે. ઓરડાની વચ્ચે લટકાવાયેલ ઝુભર, મંદિરના ગર્ભગૂહમાં રખાયેલ ટમટમતો દીવડો, ઉત્સવીય સ્થાનના પ્રવેશ પર રાખવામાં આવેલ ધંટ, બગીચાની વચમાં બનાવાયેલ ફુવારો કે તેના જેવી રચના – આ તથા આવી બાબતોથી સ્થાપત્ય તથા તેની આજુબાજુના વિસ્તારમાં કેન્દ્ર સ્થાપિત થાય છે – એક ચોક્કસ બિંદુ અસ્તિત્વમાં આવે છે. આવી જ રીતે રેખાના બંને છેડા પર, ચોરસ જેવી આકૃતિના ખૂણે કે ખૂણાના શીર્ષસ્થાને પણ વૈચારિક બિંદુ સ્થપાતાં હોય છે. બિંદુથી જ જોડાણ, શરૂઆત કે અંત નિર્ધારિત થાય. સ્થાપત્યમાં પરોક્ષ રીતે આવાં બિંદુ સ્થપાતાં જ હોય છે.

બિંદુની રચના પોતે એક નિશ્ચયપૂર્વકનો દઢ નિર્ણય ગણાય છે. એક વાર તેની રચના થઈ ગયા પછી તેની અવગણના નથી સંભવી શકતી. તેની હાજરીની નોંધ બધાએ લેવી જ પડે છે. તેથી ભૌતિકતાની દણિએ તે બિનવજનદાર અંગ ગણાતું હોય પણ પ્રતીતિ તથા અનુભૂતિની દણિએ તે સશક્ત છે.

બિંદુથી સ્થાન નિર્ધારિત થાય. વળી તેનાથી જ તે સ્થાનમાં કેન્દ્રીયતા પણ આવે. સ્થાપત્યમાં જે તે સ્થાને બિંદુ સ્થાપવાથી આજુબાજુનો વિસ્તાર જાણે તેને સંલગ્ન બની જાય – આ વિસ્તાર તે બિંદુ તરફ ચોક્કસ પ્રકારનું સંબોધન કરતો હોય તેમ લાગે. વળી સ્થાપત્યમાં બિંદુ પ્રયોજનવાથી તે ક્ષેત્રમાં અગ્રતાકમ ઊભો થાય – બિંદુ અને તેની નજીકનો વિસ્તાર મહત્વનો બને અને આ મહત્વ બિંદુથી દૂર જતાં ઓછું થતું જાય. બિંદુના પ્રયોજનથી જે તે સ્થાન વધુ ધ્યાનાકર્ષક પણ બને. આ બિંદુ સપાઈ પર ન હોય અને જો વૈચારિક સ્વરૂપે અવકાશમાં સ્થાપાયું હોય તો તેનાથી નાટકીયતા તો આવે જ, પણ સાથે સાથે તે સ્થાનની ત્રિપરિમાણીયતાની અનુભૂતિ પણ દઢ બને. સ્થાપત્યમાં જો એક કરતાં વધુ બિંદુઓ પ્રયોજયાં હોય તો તે બિંદુઓ માનસિક રીતે પરસ્પર જોડાઈને એક વિશેષ પ્રકારની સામૂહિકતા તથા સંલગ્નતા સ્થાપત્યમાં અનુભવાય, પરિસ્થિતિ એકબીજાં સાથે દફ્તાથી સંકળાયેલી જણાય. આ બધાં સાથે બિંદુ મૂળમાં નાનકું હોવાથી તેના પ્રયોજનથી કયાંક હળવાશ પણ આવે.

ઈલોરાના કેલાસ મંદિરના ખુલ્લા પ્રાંગણમાં આવેલ સ્તંભથી બિંદુ સ્થાપી તે ખુલ્લી જગ્યાનું મહત્વ અનેકગણું વધારી દેવાયું છે. નાગર શૈલીના દરેક મંદિરનું શિખર તે તેના શીર્ષ બિંદુ થકી આકાશની વિશાળતા સાથે જાણે સંપર્ક સાધે છે. ફ્લોરેન્સના ચર્ચના ગુંબજની નીચે સૌથી મહત્વનું કેન્દ્ર સ્થપાય છે. ઓલિમ્પિક સ્ટેડિયમની જ્યોત પ્રતીકાત્મક રૂપે સમગ્ર સમારોહનું કેન્દ્ર બને છે. બૂહાત્મક સ્થાને કરેલી રંગોળી તે સ્થાનને સંન્માનજનક બનાવી કેન્દ્રસ્થાને લઈ આવે છે. આમ સ્થાપત્યમાં રચાયેલ બિંદુ ઘણી હકારાત્મક અસરો ઊભી કરે છે. જોકે વિશાળ કક્ષની મધ્યમાં આવેલ સ્તંભથી રચાયેલ બિંદુ કયાંક ઉપયોગિતામાં નહતરરૂપ પણ બને.

સ્થાપત્યમાં બિંદુ નાનું હોવા છતાં રાઈના દાણા સમાન છે.

— હેમંત વાળા

વાચકમિત્રાને

છેલ્લાં બાવીસ વર્ષથી ‘વિશ્વવિહાર’ આપને મળે છે. આપને તે રુચ્યું હોય અને ઉપયોગી લાગ્યું હોય તો તેનું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦નું મ. ઓ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, રમેશપાર્કની બાજુમાં, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ — એ સરનામે મોકલશો. ગ્રાણ વર્ષનું લવાજમ (૪૫૦ રૂ.) પણ એકસાથે ભરી શકાશે. ડ્રાફ્ટ કે એક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના નામનો મોકલવો.

ઈ-લવાજમ ભર્યા પછી સંસ્થાને ઈ-મેઈલ (vishvakoshad1@gmail.com),

વોટ્સએપ (9898042699) તથા પત્ર દ્વારા જાણ કરવી.
A/c. Name : Gujarat Vishvakosh Trust, A/c. No. : 09330100008481
Bank Name : Bank Of Baroda, Usmanpura Branch
IFS Code : BARB0USMANP (5th Character is Zero)



બધાં જ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે

એક જ ચાર્જર શક્ય છે ?


આજની દુનિયામાં દર વર્ષે સાડા પાંચ કરોડ ટન ઈ-વેસ્ટ એકટો થાય છે અને એમાંથી માત્ર ૧૭ ટકાનો જ નિકાલ થાય છે. બાકીનો ઈલેક્ટ્રોનિક્સ કચરો પૃથ્વીના પટમાં વેરાયેલો પડ્યો રહે છે. આ કચરો પર્યવર્તણને તો નુકસાન કરે જ છે, પરંતુ સાથોસાથ માનવસહિત સળ્ખવસ્તુઓનું ઉપર પણ ભયજનક છે. ઈ-વેસ્ટના નિકાલ માટે દુનિયાભરમાં હવે કાયદા ઘાડાઈ રહ્યા છે અને ધીમે ધીમે એ બાબતમાં વિશ્વમાં ગંભીરતા આવી છે, પરંતુ આ સમસ્યાનો નક્કર ઉકેલ અત્યારે તો જણાતો નથી.

આ સ્થિતિ વચ્ચે યુરોપિયન સંઘે ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને બધા જ ડિવાઈસ માટે કોમન ચાર્જરની ભલામણ કરી છે. ૨૦૧૮માં યુરોપિયન સંઘે એક સર્વેક્ષણ કરાવ્યું હતું, એમાં જ્ઞાયું હતું કે અડધોઅડધ યુઝર્સ પાસે માઈકો-બી ચાર્જર છે. ૨૮ ટકા યુઝર્સ યુઅસબી-સી ચાર્જરથી ચાર્જ થતી ડિવાઈસ તરફ વળ્યા છે. ૨૧ ટકા યુઝર્સ લાઈટ કનેક્ટરથી ચાર્જ થતી એપલની ડિવાઈસનો ઉપયોગ કરે છે. યુઅસબી ટાઈપ-સીના યુઝર્સ સતત વધતા જાય છે. મોટા ભાગની મોબાઇલ-ઉત્પાદક કંપનીઓ પણ એ પ્રકારની ડિવાઈસ બનાવે છે એટલે સમયની જરૂરિયાત પારખીને યુરોપિયન યુનિયને નિર્ણય કર્યો છે કે દરેક કંપનીએ આગામી બે વર્ષમાં તમામ મોબાઇલ ડિવાઈસ માટે એક્સરાખું ચાર્જર રાખવું પડશે. આ નિર્ણયની સૌથી વધુ અસર આઈફોન પર પડશે. એપલનું ચાર્જર બધી જ કંપનીઓના ચાર્જર કરતાં અલગ છે. વળી ચાર્જર બાબતે એપલની ઈજારાશાહી છે. બીજા કોઈ પણ મોબાઇલનું ચાર્જર એપલમાં ચાલતું નથી અને એપલનું ચાર્જર બીજા કોઈ મોબાઇલમાં ચાલતું નથી.

બીજી બધી મોબાઇલ કંપનીઓ ટાઈપ-સી ચાર્જર આપવા માંગી છે. હેડફોન કે બ્લૂટૂથ જેવી ડિવાઈસને ચાર્જ કરવા માટે માઈકો-બી ચાર્જરની જરૂર પડે છે, પરંતુ એ સિવાય મોટા ભાગના એન્ફ્રોઇડ ફોન યુઅસબી ટાઈપ-સીથી ચાર્જ થાય છે. આ કંપનીઓએ એન્ફ્રોઇડ ફોન માર્કેટમાં મૂક્યા, ત્યારે માઈકો-બી ચાર્જરથી ચાર્જ થતા હતા, પરંતુ તેમણે માર્કેટની જરૂરિયાત પ્રમાણે અને બદલાતી ટેકનોલોજીને સ્વીકારીને ટાઈપ-સી આપવાનું શરૂ કર્યું છે. એપલે એમાં કોઈ ફરજાર કર્યો નથી. બધાથી જુદી ઓળખ જાળવી રાખવા એપલે લાઈટિંગ પ્રકારના ચાર્જરનો ટ્રેન્ડ બદલ્યો નથી.

યુરોપિયન સંઘના નિર્ણય પછી બે વર્ષમાં એપલે ફરજિયાત ટાઈપ-સી ચાર્જર આપવું પડશે અથવા યુરોપમાં વેચાણ બંધ કરવું પડશે. એપલ પાસે ત્રીજો રસ્તો વાયરલેસ ચાર્જરનો જ બાકી રહેશે. માત્ર યુરોપના માર્કેટ માટે આઈફોન રિડિજાઈન કરવાનું કામ

The most common charging connectors



કપડું છે. એવું કરવામાં જોખમ એ છે કે અત્યાર સુધી એપલે જે ઈજરાશાહી જગતી રાખી છે એ તૂટી જશે.

યુરોપિયન સંઘનો આ નિર્ણય દુનિયાને નવો રસ્તો બતાવશે એ નક્કી છે. ઈ-વેસ્ટ ઘટાડવા માટે આ પગાંબું દૂરગામી સાભિત થશે. અત્યારે દુનિયાભરમાં સ્થિતિ એવી છે કે જુદી જુદી ડિવાઈસ પ્રમાણે ચાર્જર અલગ રાખવાં પડે છે. લેપટોપનું ચાર્જર અલગ. મોબાઇલનું ચાર્જર વળી જુદું. બ્લૂટૂથ-હેડફોન વગેરેનાં ચાર્જર એ બંનેથી સાવ બિન્ન.

ઘરમાં ઈ-વેસ્ટ કેવી રીતે સરજાય છે? એક ઉદાહરણ જુઓ. તમે બે-એક વર્ષ પહેલાં એક સારી કંપનીનો ૨૦-૨૫ હજાર રૂપિયા બચ્યાનિ એન્ડ્રોઇડ ફોન લીધો હતો. એની સાથે ચાર્જર આવ્યું નહોતું એટલે વળી એ જ કંપનીના એડપ્ટર અને કેબલ પણ સાથે મંગાવ્યા હતા. એ જ અરસામાં એક હેડફોન મંગાવ્યો. એની સાથે નવું ચાર્જર આવ્યું. એક-બે વર્ષ પછી તમને કોઈ લેટેસ્ટ ફોન ગમી જાય એટલે તમારી પાસે જે ફોન છે એ તમે એક્સ્પેન્ઝ ઓફરમાં ઓનલાઈન આપી દીધો. જે ઈ-કોમર્સ કંપનીમાં તમે એક્સ્પેન્ઝ કર્યો છે એ માત્ર ફોન જ લઈ જશે. તમે અલગ જે કેબલ અને એડપ્ટર મંગાવ્યા હતા એ ઘરમાં પડ્યા રહેશે. નવા ફોનની સાથે તમે વળી અપડેટ વાયરલેસ બ્લૂટૂથ મંગાવ્યા. એની સાથે ફરી પાછો કેબલ આવ્યો. જૂનાં હેડફોન અને કેબલ તો ઘરમાં પડ્યાં જ છે. બ્લૂટૂથ અને હેડફોન બંનેમાં માઈક્રો યુએસબી ચાલે છે અને નવો સ્માર્ટફોન ટાઈપ-સીથી ચાર્જ થાય છે. સરવાળે તમારી પાસે જૂના ફોનનું, નવા ફોનનું, હેડફોનનું તેમ જ નવા વાયરલેસ બ્લૂટૂથનું - એમ ચાર ચાર્જર ભેગા થઈ જશે. એમાંથી નિયમિત ઉપયોગમાં તો માત્ર બે જ આવવાનાં છે, બાકીનાં બે ઘરમાં થોડો વખત આમતેમ રજણશે અને પછી અંતે કચરામાં જશે.

આ ઘર ઘરની કહાની છે. દુનિયાભરમાં આ જ રીતે ચાલી રહ્યું છે. સ્માર્ટફોન, ટેલ્વિઝન, હેડફોન, પોર્ટબલ સ્પીકર, વીડિયો ગેઈભ્સ, ફિલ્મેસ ટ્રેકર્સ, સ્માર્ટવોચ, ઈયરબ્રૂસ વગેરેમાં એક્સરખાં ચાર્જર ચાલતાં નથી. તેના કારણો એનો ઉપયોગ કરનારને પણ બધાના અલગ અલગ કેબલ સાચવવા પડે છે. મોબાઇલ સહિતની મોટી ડિવાઈસની વાત બાજુએ રાખીએ, તોપણ આવા ઈ-વેસ્ટનો દર વર્ષ ગંજ ખડકાઈ જાય છે. ઈ-વેસ્ટમાં મોટી ડિવાઈસની રિસાઈકલ પ્રોસેસ થાય છે. નાના નાના આવા

કચરાનો કોઈ જ સરખો નિકાલ થતો નથી એટલે એનો જથ્થો વધતો રહે છે. જો એક જ ચાર્જરથી બધી જ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ ચાર્જ થવા માટે તો, ઈ-વેસ્ટમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે.



ધ યુઅસબી ઈમિલમેન્ટર્સ ફોરમ નામનું એક

સંગઠન ૧૮૮૮માં બન્યું હતું. તે દરેક કંપનીના યુઅસબીને સંભાળે છે. યુઅસબી બનાવનારી કંપનીઓએ મળીને આ સંગઠન રચ્યું હતું. આઈબીએમ, ઈન્ટેલ, માઇક્રોસૉફ્ટ, ડિજિટલ, એનઈસી, નોર્ટલ જેવી કંપનીના સંયુક્ત પ્રોજેક્ટના ભાગ રૂપે યુઅસબી કનેક્ટર ડેવલપ થયું હતું. ત્યારબાદ એમાં એચ્પી, એપલ જેવી કંપનીઓ પણ જોડાઈ હતી. પહેલી વખત યુઅસબી ૧૮૮૮માં રિલીઝ થયા બાદ આ સંગઠને અલગ અલગ તબક્કે લગભગ ૩૦ પ્રકારના યુઅસબીને પરવાનગી આપી હતી, પરંતુ હવે ગણીને ૧૪ યુઅસબી કનેક્ટર એક્સ્ટ્રોન છે. એમાંથી સૌથી વધુ યુઅસબી-સી વપરાય છે. યુઅસબી ટાઈપ-સી યુઅસબી ઈમિલમેન્ટ ફોરમે ૧૧મી ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ લોંચ કર્યું હતું. તેટા ટ્રાન્સફરની ઝડપ વધારવા માટે આ યુઅસબી કનેક્ટર ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું હતું, તેના કારણે મોટાભાગની મોબાઇલ ઉત્પાદક કંપનીઓ ટાઈપ-સી તરફ વળી ગઈ હતી. ટાઈપ-સીની લોકપ્રિયતાના કારણે ૩.૫ એમેચેમ ઓડિયો જેક્સ, યુઅસબી-બી, યુઅસબી-૧ અને ડિસ્લેપોર્ટનું ચલણું એકાએક ઘટી ગયું હતું. ટાઈપ-સી કનેક્ટર સેકન્ડમાં ૧૦ ગીગાબાઈટ સુધીની જરૂરે તેટા ટ્રાન્સફર થઈ શકે છે. ૧૦૦ વોટ્સસ સુધીનો પાવર પણ એમાંથી ડિવાઈસને મળી શકે છે. તેના કારણે તેટાની સ્પીડની જેમ ટાઈપ-સીથી મોબાઇલની ચાર્જિંગ સ્પીડ પણ ઘણી વધારે મળે છે. યુઅસબી-સીને સતત અપડેટ કરવાની પ્રક્રિયા પણ ચાલતી રહે છે. લેટેસ્ટ સ્માર્ટફોનમાં અપડેટ યુઅસબી-સી ઈન્સ્ટોલ હોવાથી તે તુરંત ચાર્જ થઈ જાય છે.

ટાઈપ-સી ચાર્જરથી મોબાઇલ ફોન તો ચાર્જ થાય જ, પરંતુ બ્લૂટૂથ ડિવાઈસ, ડેડ્ફોન, પોર્ટબલ સ્પીકર, વીડિયો ગેઈમ્સ, કેમેરા, સ્માર્ટવોચ, ફિનેસ ટ્રોકર્સ, ટેબ અને લોપટોપ સહિતનાં બધાં જ રોજિંદા વપરાશનાં ઉપકરણો ચાર્જ થાય તો આપણે એક જ ચાર્જર રાખવું પડે.

એક દશક પહેલાં અલગ અલગ ડિવાઈસને ચાર્જ કરવા માટે ૩૦ પ્રકારનાં ચાર્જરો અસ્થિત્વમાં હતાં. સ્માર્ટફોન નિર્માંતા કંપનીઓ મોડલ પ્રમાણે અલગ અલગ પ્રકારનાં ચાર્જર યુગરને આપતી હતી, પરંતુ એક દશક પછી સ્થિતિ એટલી સુધીરી છે કે હવે મુખ્યત્વે ત્રણ પ્રકારનાં ચાર્જર જ અસ્થિત્વમાં રહ્યાં છે. એમાંથી પણ જો બધું એક જ ચાર્જરથી ચાર્જ થવા માટે તો ઈ-વેસ્ટ ઓછો જનરેટ થાય. તે સિવાય યુઝર્સને પણ અલગ અલગ ચાર્જરમાંથી મુક્તિ મળે અને અલગ અલગ ચાર્જર ખરીદવાનો ખર્ચ પણ નિયંત્રિત થાય. યુરોપિયન સંઘનો આ પ્રયોગ સફળ થશે તો આગામી પાંચ-સાત વર્ષમાં દુનિયાભરમાં એનું અનુકરણ થશે એ નક્કી છે.

— હર્ષ મેસવાણીયા



પૃથ્વીની મૂડીનું વ્યાજ ચૂકવીએ



અંગરાજ સ્વામી

પાસેથી પસાર થવું ફરતું અને એ હંમેશાં વિચારતો — આવી પરિસ્થિતિને બદલવા માટે હું શું કરી શકું ?

એના મનમાં એ વાત પાકી થઈ હતી કે વેસ્ટ મેનેજમેન્ટના કેતે યોગ્ય રીતે કામ કરવામાં આવે તો તેમાંથી કમાણી થઈ શકે તેમ છે. સંશોધન દરમિયાન એને જીણવા મળ્યું કે ભારતમાં દર વર્ષ એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાનો કચરો ગમે તેમ ઠગલાના સ્વરૂપે પડ્યો હોય છે, કારણ કે કચરાને અલગ રાખી એકત્ર કરવો એવી કોઈ સમજ હજી આપણે ત્યાં વિકસી નથી. જ્યારે જીપાનમાં અગિયાર પ્રકારના, અમેરિકામાં આઈ અને ચીનમાં ચાર પ્રકારના કચરા જુદા પાડવામાં આવે છે.

રાજस્થાનના શાહપુરા ત્રિવેણી ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા અંગરાજ સ્વામીએ ૨૦૧૭માં જ્યપુરમાં ઈકોરેપ (Ecowrap) અર્થાત્ ઈકો વેસ્ટ એન્ડ રિસોર્સિસ એક્શન પ્રોગ્રામ શરૂ કર્યો. સૌપ્રથમ તો એણે જોયું કે આપણે ત્યાં લીનિયર ઈકોનોમી પર કામ થઈ રહ્યું છે અર્થાત્ તમે એક ખુરશી ખરીદી, તે તૂટી ગઈ, તેને ફેંકી દીધી અને નવી ખરીદી. જ્યારે સક્રૂલર ઈકોનોમીમાં તે તૂટેલી ખુરશીને રિસાઈકલિંગ માટે આપવામાં આવે છે, જેથી તે કચરામાં નહીં જાય. સક્રૂલર ઈકોનોમીના ઉદેશ સાથે તેણે ઈકોરેપ પ્રોગ્રામ શરૂ કર્યો. સૌપ્રથમ આ કેતનો અભ્યાસ કરીને તેણે જાણ્યું કે આ કેતે સરકાર કામ કરી રહી છે, પરંતુ સમસ્યા લોકભાગીદારીની જાગરૂકતાની છે. બહુ ઓછા લોકો કચરાને અલગ કરીને

દિલ્હી યુનિવર્સિટીમાં ફિઝિક્સમાં સ્નાતકની ડિગ્રી લેનાર અંગરાજને અભ્યાસ દરમિયાન એટલું તો સમજાઈ ગયું હતું કે વેસ્ટ મેનેજમેન્ટ માટે કંઈક કામ કરવું જોઈએ. ૨૦૧૪માં એનો અભ્યાસ પૂરો થયા પછી એમણે દિલ્હીના ચાંદની ચોકમાં પોતાનું પેપર રિસાઈકલિંગનું એક યુનિટ શરૂ કર્યું હતું, પરંતુ સરકારે પેપર પર એક્સાઈજ જ્વાટી વધારી દીધી, તેથી ૨૦૧૬માં યુનિટ બંધ કરવું પડ્યું, પરંતુ એ જ્યારે જ્યારે એની હુકાનેથી ઘરે જતો, ત્યારે એને દિલ્હીની મફરબા ચોકમાં ઉમ્પસાઈટ

કચ્ચરાપેટીમાં નાખવો તેને પોતાનું કર્તવ્ય સમજે છે. મોટાભાગના લોકોને આ કામ બેકાર લાગે છે અને બીજી સમયા ભારતમાં આ માટેનું ઈન્ફાસ્ટ્રક્ચર જોઈએ એટલું વિકસ્યું નથી. તમારે પ્લાસ્ટિક વેસ્ટને રિસાઈકલ માટે ક્યાં આપવો તેની જાણકારી નથી. આ બધી સમયાઓને સમજીને અંગરાજે સૌપ્રથમ હોટલ, રેસ્ટોરન્ટ અને કાફી (HORECA) ઈન્ડસ્ટ્રી પર નજર ઠેરવી, કારણ કે ત્યાં ઘણો કચરો એકત્ર થાય છે અને તેમાં કામ કરતા કર્મચારીઓને તાલીમ આપીને કામ કરાવી શકાય છે. તેથી એણે જયપુરની હોટલોમાં સંપર્ક કરવાનું શરૂ કર્યું. હોટલવાળા જે અને કચરો સમયસર અલગ કરીને આપે તો અંગરાજ એના પૈસા આપશે એવી સમજૂતી થઈ.

આમાં વધેલું ખાવાનું, કાચની બોટલ અને વાસણ, પ્લાસ્ટિક અને ટેટ્રાપેક તથા રેપર એમ ચાર અલગ કચરા એમના માણસો એકઠા કરી રહ્યા છે. અત્યારે તે આશરે ૧૨૮ હોટલો સાથે કામ કરે છે અને રોજ ૧૨૦ મેટ્રિક ટન કચરો એકઠો થાય છે. આ કચરાને તેઓ સોળ જેટલા રિસાઈકલર્સને ત્યાં મોકલે છે. એમને ત્યાં આવતા કચરામાંથી પંચાંશું ટકા કચરો રિસાઈકલિંગ માટે મોકલે છે. જ્યારે અન્ય કચરામાંથી તેઓ અપસાઈકલિંગ કરે છે. જેમ કે, કાચની બોટલમાંથી ડેકોરેટિવ લોભ્ય, ટાયરમાંથી ખુરશી, સોફા બનાવડાવે છે. આને માટે બાર ગ્રામીણ મહિલાઓને તાલીમ આપી છે. અંગરાજની ટીમમાં અન્ય ત્રણ સહસ્થાપકો પણ છે. આજે એમની ટીમમાં ડ્રાઇવર સહિત બાર સહ્યો છે. તેઓ સર્ટેનોપ્રેન્નોરશિપના વિચાર સાથે કામ કરે છે.

અંગરાજે પોતાની બચતમાંથી આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. અન્ય મિત્રો જોડાતા ગયા અને આવક વધતી ગઈ તેમ તેમ એને ચલાવવાનું આસાન બનતું ગયું. આજે એમણે અગિયાર લાખ રૂપિયાનું રોકાશ કર્યું છે અને સામે ગયા વર્ષ સુધીમાં પિસ્તાળીસ લાખની આવક થઈ હતી. તે કહે છે કે બહારથી મૂડી મેળવવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ આવો બિઝનેસ તમને પૈસા રણી આપે એવી વાતમાં કોઈને વિશ્વાસ નથી. આગામી બે વર્ષમાં છ હજાર મેટ્રિક ટન કચરો રિસાઈકલિંગ માટે મોકલીને તેઓ વર્ષે ત્રણ કરોડની આવકનું લક્ષ્ય રાખે છે.

આજે ભારતમાં વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરતી ત્રણ-ચાર મોટી કંપનીઓ છે, પરંતુ સક્ર્યુલર ઈકોનોમીના લક્ષ સાથે કામ કરનાર ઈકોરેપ છે. અંગરાજ માને છે કે લોકોને એમ લાગે છે કે આપણે કંઈ કરીએ કે ન કરીએ તેનાથી કોઈ ફર પડતો નથી, પરંતુ જે પ્રકૃતિ, પૃથ્વીમાં આપણે રહીએ છીએ તેનું આપણા માથે કરજ છે. જો એને આપણે મૂળ મૂડી સાથે વ્યાજ ન આપી શકીએ તો ઓછામાં ઓછું મૂળને-મૂડીને-તો સહીસલામત રીતે પાછું આપી જ શકાય.

— પ્રીતિ શાહ



પ્રદ્યુમન તન્ના - ચિત્રકાર, કવિ, ફોટોગ્રાફર, લેખક



પ્રદ્યુમન તન્ના
 પ્રદ્યુમન તન્ના માસ-પ્રચૂર હોય જ હોય ! તેમજો શબ્દ અને રેખા દ્વારા કવિતા વહાવી છે. તેમનાં કાવ્યોને શ્રી લાભશંકર પુરોહિતે નવાજ્યાં છે : ‘આનાં આધા ભણકારા ૫૦-૬૦ના દાયકામાં અંતર્ભાઈનું જનપદી રંગોને ધારતી પ્રદ્યુમન તન્નાની ગીતરચનાઓમાં પહેલે-પ્રથમ સાંભળવા મળે છે.’

તન્ના પરિવાર મૂળ સૌરાષ્ટ્રના. વડવાઓ આજીવિકાની શોધમાં વતન છોડીને, પાલઘર જિલ્લાના આદિવાસી ગામ દહાણુમાં આવીને વસ્યા. પ્રદ્યુમનનો જન્મ દહાણુમાં ૭ જુલાઈ, ૧૯૮૨ટામાં થયો. માધ્યમિક સુધીનું ભણતર દહાણુમાં થયું. નાનપણથી કળાનો રસિયો જીવ. વધુ અભ્યાસ માટે મુંબઈ જે. જે. આર્ટ સ્કૂલમાં જોડાયા. ગ્રાફિક ડિઝાઇનની ડિગ્રી મેળવીને ટેક્સ્ટાઈલ ડિઝાઇનર તરીકે મુંબઈની મિલોમાં કામ કર્યું. વળી પાછા ગ્રાફિક કળાના વધુ અભ્યાસ માટે તેઓ ઈટાલી ગયા. ત્યાં રોજાલ્બા નામની બાળા સાથે મેત્રી થઈ, પ્રેમ કરીને લગનથી જોડાયા. ભારત આવી બંનેએ ટેક્સ્ટાઈલ ડિઝાઇનર તરીકે સાથે કામ કર્યું. છતાં પણ, માપી માપીને વળતર આપતા આ દેશમાં, ઈટાલી જેવો દિલ ખોલીને કામ કરવાનો માહોલ ન મળવાથી, ફરી ઈટાલી સ્થાયી થયા. ત્યાં રહ્યા પરંતુ જીવડો ઠર્યો તો નહીં જ. ‘મત રે મુંજાણી વા’લા, સૂજે નેં કાંઈ’ – કોઈ પણ સંજોગોમાં પોતાનું પોત પાતણું ન થવા દીધું, જે કંઈ થયું તે કાવ્યમાં ઢાણું ! સંગિનીનો પણ સાથ હતો : ‘કાંઈ બેઠા રિયે કદિ ઈ કમળકૂલ ન પામે.’

આ જ્મા પાસું મોટી મિરાત હતી. તેમનો મોજલો સ્વભાવ વિવિધ કળાઓમાં ખૂબ નીખર્યો. રોજાલ્બાનો એક તાંત્રણે બંધાયેલો સાથ હતો : Voglio passare il resto della mia vita con te (બાકીનું જીવન તારી સાથે જ), પરંતુ ઈટાલીની આ ભાષામાં કાઠિયાવાડી લહેકો ન ભય્યો. ભાવિનું ભાગ્યવિધાતા તો ભારત જ બન્યું.

‘ચિત્રના ભારેખમ છતાં બળકટ વિષયને એ ચિત્ર જોનારા સારી રીતે માણી શકે તેમ રજૂ કરવું એ કલાકારની ફરજ છે, એ કસબ સાધ્ય કરી શકે તે ખરો કલાકાર કહેવાય. દમણના આદિવાસી લોકોની વચ્ચે ધૂળમાં ઊછરેલા પ્રદ્યુમને આ સમજ

ગળથૂથીમાં મળેલી હતે. ત્યાંની વિશ્વવિદ્યાત તળપટી શૈલી ‘વારલી’ની ચોટદાર રેખાઓની સુવાસ પ્રદૂભના ચિત્રકામમાં સહજ ઉત્તરી આવેલી દેખાય છે. ‘ધ્રણાણ કુંગરા ડેલે’ને વ્યક્ત કરતી કુંગરમાળની માત્ર રેખા, ચોટદાર સાદગી સાથે કવિત્વમય વાતાવરણની જમાવટ છે.’ – ‘કુમાર’ના તંત્રીનું આ વિધાન પ્રદૂભન તન્નાની કળાસૂઝને ‘ચંદ્રક’ મળ્યા સરખી શાબાશી છે ! એવું એક અન્ય ચિત્ર ‘હણહણતો ઘોડો’. ઇટાલીના શિયાળામાં ભારે હિમ પ્રપાતની ઠંડાગાર લહેરમાં પર્ણહિન વૃક્ષોની ગીય હારમાળા પાછળ ઊભેલી ગાડીનો ઊંચી ડેક કરી હણહણતો ઘોડો વાતાવરણની ઢી અને થીજેલી નિર્જનતામાં પ્રાણ પૂરે છે. લિથોગ્રાફ, વુડકટ, એચિંગ જેવી મુદ્રાક્ષભ કલાશૈલીઓ તેમણે સારી પેઠે હસ્તગત કરી હતી. ચિત્રના વિષય પ્રમાણે ઉપયોગ કરી જોઈતું વાતાવરણ જમાવી સચોટ પરિણામ લાવી શકતા હતા.

વર્ષો થયાં, થોડો સમય અમે દાદર(મુંબઈ)થી થાણે જતી સવારની લોકલ ટ્રેનમાં રોજ મળતાં. બંનેની પ્રવૃત્તિ સરખી, ટેક્સ્ટાઇલ પ્રોસેસ હાઉસમાં. પ્રદૂભ એમના જીવનની વાતો કરતાં તેમાં ‘જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા’ની ધૂવ પંક્તિ અવશ્ય રહેતી. મુંબઈમાં તેમનું મિત્ર-કલાકારોનું વર્તુળ બહોળું હતું. એમાંના ઘણાંના સ્કેચ તેમણે બનાવ્યા છે.

મુંબઈમાં તાજી સ્થપાયેલી ‘સૂર સિંગાર સંસદ’ના ભવ્ય કાર્યક્રમમાં દેશભરના જ્યાત કલાકારોને કાર્યક્રમમાં કલા સંજીવની કળામાં પ્રદૂભન તન્નાએ માનદ સેવા આપી હતી. તેઓ લખે છે : ‘અવેજ્ઞમાં અનેક નામી કલાકારો, ગાયકો, વાદકો, નર્તકોને સાવ નજીકથી જોવા માણવાનો અનરો લાભ મળ્યો. સ્ટેજ પર બિરાજેલા પંડિત ઓમકારનાથ ઠાકુર, ગિરિજાદેવી, અલી અકબરખાં, પન્નાલાલ ધોષ, રાધિકા મોહન મૈત્ર, નિખિલ બેનરજી, મુંકુંદ ગોસ્વામી, બિસ્મિલ્હાખાન વગેરેના પરભાર્યા સ્કેચ સ્ટેજ પર બેઠાં બેઠાં કર્યા અને એમના હસ્તક્ષેપના કોડીંધંથી રેખાંકનો જતને જાળવી રાખ્યા છે. માર્ય, ૨૦૦૧માં કોમો નજીકના ગામની જાણીતી કલાશાળાના ઉપકરે મારી પાંચેક દાયકાની કલાસર્જનની પ્રવૃત્તિને સાંકળતી વિવિધ માધ્યમોવાળી કલાકૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું.’

કાશ, આપણે ત્યાં પણ આવું દુંદું કામ કોઈ સંસ્થાએ યોજાયું હોત !

જીવનમાં સતત આવતા રહેલા ચડ-ઉતારની સરાણ પર પ્રદૂભન ખૂબ સારી રીતે ઘડાયા. જીવનમાં જે જે બન્યું તેની ફરિયાદ કરવા તેમની પાસે સમય જ ક્યાં હતો ? ઉંટના ઢેકાને ટેકા તરીકે કામમાં લઈ શકાયા છે, તો તેમની પાસે કોઈ પણ સ્થિતિને યોગ્ય વળાંક આપીને ઉત્કૃષ્ટ કલાસર્જન કરી બતાવવાનું કૌવત હતું જ. (એ વળાંકો તેમનાં ચિત્રોની રેખાઓમાં સતત હોય છે.) ઈશ્વરને માથે શું ટોપલો ઢોળવો ? ફરિયાદ શું કરવી ? છતાં રાધા બનીને તો કૂણણે કહી જ દીંઘું : ‘આજ લગી ચૂકવ્યા તે અરથાં માધ્યવ, રહ્યાં અરથાં તે નથી હવે ટેવાં ! ભવે ભવે આવજો વૈંકુંદથી આંહી પ્રજે, લેણાં બાકીનાં બધાં લેવા !’ આ હુનિયાએ તેમને આચ્યું તેનાથી અનેકગણશું વધારે આપીને તેઓ ૮૦ વર્ષની વય સુધી ખૂબ પ્રવૃત્ત રહ્યા અને ૨૦૦૮ના ઓગસ્ટમાં અવસાન પાખ્યા.



આગામી કાર્યક્રમો

શ્રી ભર્દંકર વિધાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

- ❖ ૮ જાન્યુઆરી, ૨૦૨૨, શનિવાર : બપોરના ૪-૦૦
વિષય : બાળવાર્તા અને બાળવાતાકથન વક્તા : યાત્રી સપાટવાલા
- ❖ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૨, બુધવાર : સાંજના ૫-૩૦
વિષય : નારીની બદલાતી છબી વક્તા : શરીફા વીજળીવાળા
- ❖ શ્રી રક્ષિકલાલ છો. પરીખ વ્યાખ્યાનમાળા
- ❖ ૧૬ જાન્યુઆરી, ૨૦૨૨, બુધવાર : સાંજના ૫-૩૦
વિષય : વારલી પેઇન્ટિંગ વક્તા : અરવિંદ ગોસાલકર

સ્મૃતિ-વ્યાખ્યાન

ગુજરાતી વિશ્વકોશના પ્રણોત્તા અને શિલ્પી

પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન

- ❖ ૨૪ જાન્યુઆરી, ૨૦૨૨, સોમવાર : સાંજના ૫-૩૦
વિષય : તુકારામ અને નરસિંહ મહેતાનો ભક્તિભાવ
વક્તા : અરુણા જીઠેજા

વિદુષી શ્રી દક્ષાબહેન પહૃણી સ્મૃતિ-વ્યાખ્યાન

ગાંધીનિર્વાણની પૂર્વ સંધ્યાએ

- ❖ ૨૮ જાન્યુઆરી, ૨૦૨૨, શનિવાર : સાંજના ૫-૩૦
વિષય : ગાંધી : આવતી કાલે વક્તા : સંજ્ય-તુલા

શ્રી કંચનલાલ પરીખ સ્મૃતિ-વંદના

- ❖ ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨, રવિવાર : સવારે ૧૦-૩૦ વાગ્યે
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપક-ટ્રસ્ટી અને જાણીતા શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ (ડે. સી. પરીખ) તથા શિક્ષણ અને સમાજસેવાનું કાર્ય કરનાર શ્રી ભાનુબહેન પરીખ વિશે શ્રી શ્રેયસી પરીખે લખેલાં સ્મરણો ‘શ્રેયોપાસના’નું શ્રી રઘુવીર ઘૌધરીના હસ્તે વિમોચન તથા શ્રી ડે. એસ. શાસ્ત્રી, શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી મુકેશ પટેલ અને શ્રી ચિંતન પરીખનાં વક્તવ્યો. કાર્યક્રમ સંચાલન : ડૉ. વિનીત પરીખ

આસ્વાદ

- ❖ ૨૯ જાન્યુઆરી, ૨૦૨૨, રવિવાર : સવારના ૧૦-૦૦થી ૧૨-૦૦ દરમિયાન
વિશ્વકોશભવનના શેઠ હઠીસિંહ કેસરીસિંહ સભાગૃહમાં જાણીતા લોકકલાવિદ શ્રી જોરાવરસિંહ જાદવ ‘ગુજરાતની લોકકલાકારો’ વિશે વક્તવ્ય આપશે.



મકરણ દવેના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે એમનાં તથા અન્ય કવિઓનાં કાવ્યોની
અમર ભંડ દ્વારા પ્રસ્તુતિ



‘ગ્રંથ’ના અનોખા ઉપાસક યશવંત દોશી
વિશે હસિત મહેતા



હિંદી ફિલ્મ ‘રૂઈ કા બોજ’ની
સમીક્ષા કરતા અમિતાલ મડિયા



‘ભારતીય કલાની અજ્ઞાણી વાતો’
વિશે નિસર્ગ આહીર

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનાં પ્રકાશનો નીચેના સ્થળોથી મળશે.

: પ્રાપ્તિસ્થાનો :

ગૂર્જર સાહિત્યભવન

રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ,
અમદાવાદ-380001
email : goorjar@yahoo.com
ફોન નં. 079 - 22149660

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

૫૧/૨, રમેશપાર્કની બાજુમાં,
વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા,
અમદાવાદ-380013
ફોન નં. 079 - 27551703
email : vishvakoshad1@gmail.com

ગૂર્જર સાહિત્ય પ્રકાશન

૧૦૨, લેન્ડમાર્ક બિલ્ડિંગ,
ટાઈટેનિયમ સિટી સેન્ટરની બાજુમાં,
૧૦૦ ફૂટ આનંદનગર રોડ,
પ્રષ્ટલાંનગર, અમદાવાદ-380015
ફોન નં. 079 - 26934340,
મો. - 98252 68759

કોસવડ

બી-૬, શ્રી કિષ્ણા સેન્ટર,
મીઠાખળી સર્કલ પાસે,
અમદાવાદ-380009
ફોન નં. 079 - 26468931
email : latitudeahdac@gmail.com

સદ્વિચાર પરિવાર

સમર્પણ વિદ્યાપીઠ, સેટેલાઈટ રોડ,
રામદેવનગર, અમદાવાદ-380015
ફોન નં. 079 - 26860197
email : sdparivar.org@gmail.com

ગુંથવિછાર

ગુજરાતી સાહિત્ય પરિષદ,
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ,
નાટકિનારે, આશ્રમરોડ,
અમદાવાદ-380009
ફોન નં. 079 - 26587949,
મો. 98987 62263

